



નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ



પરિપત્ર નં. ૧૦૪ A તા. ૧૨-૦૧-૨૦૨૪

ફક્ત મ્યુનિ. શાળાઓ માટે જ :-

વિષય :- ખેલમહાકુંભ ૨.૦ અંતર્ગત મ્યુનિ. શાળાઓમાં સ્પર્ધાઓનું આયોજન કરવા બાબત.

સંદર્ભ :- ક્રમાંક: પ્રાપ્રક/નરોડા/ખેલમહાકુંભ૨.૦/૫૧૩ થી ૨૪/૨૦૨૩-૨૪, તા. ૦૫-૦૧-૨૦૨૪

આથી તમામ મ્યુનિ. શાળાના મુખ્યશિક્ષકશ્રીઓને ઉપરોક્ત વિષય અને સંદર્ભે જણાવવાનું કે, અમદાવાદ મહાનગરપાલિકા ખેલમહાકુંભ ૨.૦ ની વોર્ડ, ઝોન અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાનું આયોજન આ સાથે સામેલ પત્રકમાં દર્શાવ્યા મુજબ થનાર છે. જે અંગેની જાણ આપની શાળાના ભાગ લેનાર ખેલાડીઓને કરવા જણાવવામાં આવે છે. સ્પર્ધા અંગેની વિગતવાર માહિતી તેમજ સ્પર્ધાનું પત્રક આ સાથે સામેલ રાખેલ છે.

તા. ૧૨-૦૧-૨૦૨૪

ડૉ. એલ. ડી. દેસાઈ
શાસનાધિકારી



સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત
જિલ્લા રમત વિકાસ અધિકારી, અમદાવાદની કચેરી
જિલ્લા રમતગમત સંકુલ, રૂક્મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલની સામે,
ખોખરા, મણિનગર (પૂર્વ), અમદાવાદ - ૩૮૦૦૦૮ ફોન નં. (૦૭૯)-૨૨૭૮૨૩૨૩
ઈ-મેઈલ આઈ-ડી: dsdo-ahmedabad@gujarat.gov.in

ક્રમાંક: પ્રાપ્રક/નરોડા/ ખેલમહાકુંભ 2.0/૫૧૩થી૫૨૪/૨૦૨૩-૨૪

તા.૦૫/૦૧/૨૦૨૪

વોર્ડ/ઝોન/મહાનગરપાલિકાકક્ષા

પ્રતિ,

આચાર્યશ્રી શૈક્ષણિક સંસ્થાઓ તમામ

આચાર્યશ્રી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા તમામ (શહેર)

પ્રમુખ/મંત્રીશ્રી, અમદાવાદ જિલ્લા વ્યાયામ પ્રચારક મંડળ

પ્રમુખ/મંત્રીશ્રી, અમદાવાદ જિલ્લા કક્ષાના સંબંધિત રમતના માન્ય એસોશીએશન

અમદાવાદ શહેર.

વિષય: ખેલમહાકુંભ 2.0 અંતર્ગત અમદાવાદ શહેરની વોર્ડ/ઝોન/મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધાના આયોજન બાબત

સંદર્ભ: માન.ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના તા.૦૨/૧/૨૦૨૪ ના સુધારા પરીપત્ર

ક્રમાંક: એસએજી/ખેમકું ૨.૦/૨૦૨૩-૨૪ અન્વયે.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય પરત્વેના સંદર્ભ દર્શિત પત્ર અન્વયે સવિનય જણાવવાનું કે, અમદાવાદ મહાનગરપાલિકાની ખેલમહાકુંભ

2.0 ની વોર્ડ, ઝોન અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા નું આયોજન આ સાથે સામેલ પત્રકમાં દર્શાવ્યા મુજબ થનાર છે. જે

અંગેની જાણ આપની સંસ્થા અને શાળાના ભાગ લેનાર ખેલાડીઓને કરવા વિનંતી છે. સ્પર્ધા અંગેની વિગતવાર માહિતી નીચે મુજબ છે અને સ્પર્ધાનું પત્રક આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે.

બિડાણ:- (૧) વોર્ડ, ઝોન અને મહાનગરપાલિકાકક્ષાની રમતની સ્પર્ધાનું વિગતવાર પત્રક

(૨) નિયમો

જિલ્લા રમત વિકાસ અધિકારી
અમદાવાદ

શાસનાધિકારી
અમદાવાદ

જિલ્લા શિક્ષણાધિકારી
અમદાવાદ શહેર

નકલ સવિનય રવાના જાણ સારું:-

(૧) માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ.

(૨) માન. જિલ્લા કલેક્ટરશ્રી, કલેક્ટરશ્રીની કચેરી, સુભાષબ્રીજ, અમદાવાદ.

(૩) માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી, લાલ દરવાજા, અમદાવાદ.

(૪) માન. સચિવશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર

(૫) મુખ્ય કોચશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર

(૬) પ્રમુખ/મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય વ્યાયામ મંડળ.

નકલ સવિનય રવાના જાણ તેમજ જરૂરી કાર્યવાહિ અર્થે:-

(૧) સંયુક્ત માહિતી નિયામકશ્રી, માહિતી નિયામકશ્રીની કચેરી, અમદાવાદ.

(બહોળી પ્રસિધ્ધિ અને પ્રચાર પ્રસાર થવા સારું)

(૨) મેનેજરશ્રી, ૧૦૮ ઈમરજન્સી સર્વિસીસ, કઠવાડા, અમદાવાદ.

નં.રોડા/ખેલમહાકુંભ 2.0/૫૧૩થી૫૨૪/૨૦૨૩-૨૪
વોર્ડ/ઝોન/મહાનગરપાલિકાકક્ષા
આવક નં. ૪૭૯૧ તા. ૦૬-૦૧-૨૪
શાસનાધિકારી

ખેલ મહાકુંભ 2.0 વોર્ડકક્ષાની સ્પર્ધાની વિગત ૨૦૨૩-૨૪

ક્રમ નં	વોર્ડ	રમતનું નામ	તારીખ	વય જુથ	સ્પર્ધા સ્થળ-સમય	વોર્ડ મંત્રીશ્રીનું નામ અને સંપર્ક નંબર
૧	પાલડી, વાસ્તી, આંબાવાડી	અથલેટીક્સ	૦૮-૦૧-૨૪	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગુજરાત યુનિવર્સિટી અથલેટીક ટ્રેક, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. (અપોરે ૦૨:૦૦ કલાકે)	શ્રી પ્રદ્યુમ્નસિંહ ચૌહાણ ૮૬૦૧૦ ૧૦૭૦૩
		રસ્સાખેંચ	૦૯-૦૧-૨૪	બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. (અપોરે ૦૨:૦૦ કલાકે)	
		ખો-ખો	૧૦-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	રમત સંકુલ ખોખરા, રૂક્મણીબિન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		કબડ્ડી	૧૦-૦૧-૨૪	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	રમત સંકુલ ખોખરા, રૂક્મણીબિન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		વોલીબોલ	૧૧-૦૧-૨૪	બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	અંકુર સ્કૂલ, ફતેહપુરા, પાલડી. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		વોલીબોલ	૧૨-૦૧-૨૪	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	સહજાનંદ સ્કૂલ, આંબાવાડી, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		વોલીબોલ	૧૩-૦૧-૨૪	બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	સહજાનંદ સ્કૂલ, આંબાવાડી, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		કબડ્ડી	૦૮-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	આદિત્ય ઈન્ટરનેશનલ સ્કૂલ, હંસપુરા નવા નરોડા, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)	
		અથલેટીક્સ	૦૯-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	અથલેટીક્સ ટ્રેક નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચાણક્ય સ્કુલની પાસે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)	
		૨	નરોડા, નવા ફાળુનગર, નરોડા, સોજપુર, નોબલનગર	વોલીબોલ	૧૦-૦૧-૨૪	
રસ્સાખેંચ	૧૧-૦૧-૨૪	બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)			
ખો-ખો	૧૨-૦૧-૨૪	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)			
ખો-ખો	૧૩-૦૧-૨૪	બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)			

૬	ગોમતીપુર, રખિયાલ, સરસપુર, રાજપુર	વોલીબોલ	૦૮-૦૧-૨૪	ભાઈઓ બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	રાજપુર શાળા નં.૭ ઉત્તમ ડેરી સામે, શુભદામનગર, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)	શ્રી જગદિશાસિલ ચૌહાણ ૯૮૨૫૧ ૮૭૬૯૯				
		રસસાખંધ	૦૮-૦૧-૨૪	ભાઈઓ બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	અહેલેટીક્સ ટ્રેક નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચાણક્ય સ્કુલની પાસે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)					
		કબડ્ડી	૦૯-૦૧-૨૪	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)						
		ખો-ખો	૧૦-૦૧-૨૪	બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)						
			૧૧-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)						
		એલેલેટીક્સ	૧૨-૦૧-૨૪	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)						
			૧૩-૦૧-૨૪	બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)						
				ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)						
		૭	ખોખરા- અમરાઈવાડી, ભાઈપુરા, રામોલ, સીટીએમ, વિંજોલ	ખો-ખો			૦૮-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	રમત સંકુલ, ખોખરા, રૂક્મણીબેન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)	શ્રી કનુભાઈ પટેલ ૯૪૨૭૩ ૨૦૫૮૮
				કબડ્ડી			૦૯-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	રમત સંકુલ, ખોખરા, રૂક્મણીબેન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)	
વોલીબોલ	૧૦-૦૧-૨૪			ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)		શારદાબા હાઈસ્કૂલ, વરનાલ, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)				
રસસાખંધ	૧૧-૦૧-૨૪			ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	શારદાબા હાઈસ્કૂલ, વરનાલ, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)					
				ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	અહેલેટીક્સ ટ્રેક નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચાણક્ય સ્કુલની પાસે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)					
એલેલેટીક્સ	૧૨-૦૧-૨૪			ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	તાલુકા રમત સંકુલ ખાંભ્રીપુર, વાંચ ગામ, રોડ, બીબીપુર, ના- દરકોઈ, અમદાવાદ. (સવારે ૦૮:૩૦ કલાકે)					
				બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	રમત સંકુલ, ખોખરા, રૂક્મણીબેન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)					
૮	માળીનગર, કાકરિયા, દામ્ણીલીમડા, અહવામપુરા			કબડ્ડી	૦૮-૦૧-૨૪	ભાઈઓ અને બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	સેવન્ય ડે સ્કૂલ, માળીનગર, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌહાણ ૯૮૦૪૪ ૫૫૮૯૯૮		
				વોલીબોલ	૦૯-૦૧-૨૪	ખાંભ્રી તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	અહેલેટીક્સ ટ્રેક નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચાણક્ય સ્કુલની પાસે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)			
				વોલીબોલ	૦૯-૦૧-૨૪	અં-૧૪ ભાઈઓ વયજૂથ	રમત સંકુલ, ખોખરા, રૂક્મણીબેન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)			
		એલેલેટીક્સ	૧૦-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	સેવન્ય ડે સ્કૂલ, માળીનગર, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)					
વોલીબોલ	૧૧-૦૧-૨૪	અં-૧૭, ઓપન અંજ શ્રુપ ભાઈઓ	રમત સંકુલ, ખોખરા, રૂક્મણીબેન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)							
ખો-ખો	૧૨-૦૧-૨૪	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)								
ખો-ખો	૧૩-૦૧-૨૪	બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)								
રસસાખંધ	૧૩-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)								

<p>શ્રી જુમ્માભાઈ મલેક ૮૪૮૮૮૮૩૩૭૭</p>		<p>શ્રી વિરેન્દ્રસિંહ ભટ્ટોરીયા ૮૪૬૦૧ ૯૬૧૨૯</p>
<p>આઈ પી મિશન હાઈસ્કુલ, રાયખડ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)</p>	<p>આઈ પી મિશન હાઈસ્કુલ, રાયખડ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)</p>	<p>આઈ પી મિશન હાઈસ્કુલ, રાયખડ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)</p>
<p>શ્રમચ્છવી મેદાન, મજૂર ગામ પાસે, ગીતામંદિર રોડ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)</p>	<p>શ્રમચ્છવી મેદાન, મજૂર ગામ પાસે, ગીતામંદિર રોડ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)</p>	<p>શ્રમચ્છવી મેદાન, મજૂર ગામ પાસે, ગીતામંદિર રોડ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)</p>
<p>એથ્લેટીક્સ ટ્રેક નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચાણક્ય સ્કુલની પાસે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)</p>	<p>એથ્લેટીક્સ ટ્રેક નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચાણક્ય સ્કુલની પાસે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)</p>	<p>એથ્લેટીક્સ ટ્રેક નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચાણક્ય સ્કુલની પાસે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)</p>
<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>
<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>
<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>
<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>
<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>
<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>
<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>
<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>	<p>આઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)</p>

૧૭	વટવા, લાંબા, ઈસનાપુર, ઘોડાસર, ઈન્ડુપુરી	કમ્પ્યુટરી	૦૮-૦૧-૨૪	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગીતા હાઈસ્કૂલ, લાંબા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી અમ. અંશ. વસર ૯૮૨૫૪ ૩૫૨૦૦
		અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૦૯-૦૧-૨૪	અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	
		અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૧૦-૦૧-૨૪	ભાઈઓ-અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	
		રસસામંથ	૧૧-૦૧-૨૪	ભાઈઓ-અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગીતા હાઈસ્કૂલ, લાંબા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		ખો-ખો	૧૨-૦૧-૨૪	ભાઈઓ-અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગીતા હાઈસ્કૂલ, લાંબા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		વોલીબોલ	૧૩-૦૧-૨૪	ભાઈઓ-અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગીતા હાઈસ્કૂલ, લાંબા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		ખો-ખો	૦૮-૦૧-૨૪	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	લોમગાર્ડ મેદાન, નવા વાડજ. (ખપોરે ૦૨:૦૦ કલાકે)	શ્રી એન.ડી. ચૌધરી ૯૪૨૮૮ ૦૦૨૮૬
		રસસામંથ	૦૯-૦૧-૨૪	અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	લોમગાર્ડ મેદાન, નવા વાડજ. (ખપોરે ૦૨:૦૦ કલાકે)	
		અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૦૯-૦૧-૨૪	ભાઈઓ-અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	લોમગાર્ડ મેદાન, નવા વાડજ. (ખપોરે ૦૨:૦૦ કલાકે)	
		અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૧૦-૦૧-૨૪	ભાઈઓ-અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગુજરાત યુનિવર્સિટી એથલેટિક ટ્રેક, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		કમ્પ્યુટરી	૧૧-૦૧-૨૪	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	લોમગાર્ડ મેદાન, નવા વાડજ. (ખપોરે ૦૨:૦૦ કલાકે)	
		વોલીબોલ	૧૨-૦૧-૨૪	અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	લોમગાર્ડ મેદાન, નવા વાડજ. (ખપોરે ૦૨:૦૦ કલાકે)	
		વોલીબોલ	૧૩-૦૧-૨૪	ભાઈઓ-અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગુજરાત વિદ્યાપીઠ, ઈન્કમેટેક્સ ચાર રસ્તા પાસે, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		રસસામંથ	૦૯-૦૧-૨૪	ભાઈઓ-અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ચાંદપેડા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૧૦-૦૧-૨૪	ભાઈઓ-અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	શ્રીમતી માણેકબા વ્યાયામ વિદ્યાભવન, અડાલજ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી પ્રભાતસિંહ કે. ઠાકર ૯૩૭૬૧ ૭૮૪૫૬
		કમ્પ્યુટરી	૧૧-૦૧-૨૪	અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ચાંદપેડા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		ખો-ખો	૧૨-૦૧-૨૪	ભાઈઓ-અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ચાંદપેડા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		ખો-ખો	૧૩-૦૧-૨૪	અલેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ચાંદપેડા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	

ખેલ મહાકુંભ 2.0 ઓનકક્ષાની સ્પર્ધાની વિગત ૨૦૨૩-૨૪

ક્રમ નં	ઝોન	રમત	તારીખ	વય જૂથ	સ્પર્ધા સ્થળ-સમય	ઝોન મંત્રીશ્રીનું નામ અને સંપર્ક નંબર
૧	ઉત્તર ઝોન	કબડ્ડી	૧૬-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	વિવિધ એવિયર્સ હાઈસ્કૂલ, ઠાંસોલ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી જીનેન્દ પટેલ ૯૯૭૪૩ ૩૯૦૩૮
		રસ્સાખેંચ	૧૬-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	અમૃતમ ઇન્ટરનેશનલ સ્કૂલ, નાના ચિતૌડા, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)	શ્રી રીટાબેન કાણ્જરીયા ૯૯૧૩૭ ૧૬૨૧૭
		ખો-ખો	૧૭-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મેમકો, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી રણવીરસિંઘ ગોંદિલ ૯૯૭૯૧ ૪૧૦૦૪
		યોગાસન	૧૭-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	એચ્વેટીક્સ ટ્રેક નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચાણક્ય સ્કુલની પાસે, ધુન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ. (સવારે ૦૭:૩૦ કલાકે)	રીટાબેન કાણ્જરીયા ૯૯૧૩૭ ૧૬૨૧૭
		વોલીબોલ	૨૦-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	શ્રમજીવી મેદાન, મજૂર ગામ પાસે, ગીતામંદિર રોડ, અમદાવાદ. (સવારે ૦૮:૩૦ કલાકે)	
		ચેસ	૧૮-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	એચ્વેટીક્સ ટ્રેક નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચાણક્ય સ્કુલની પાસે, ધુન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		એચ્વેટીક્સ	૧૮-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	શ્રમજીવી મેદાન, મજૂર ગામ પાસે, ગીતામંદિર રોડ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		રસ્સાખેંચ	૨૩-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	એચ્વેટીક્સ ટ્રેક નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચાણક્ય સ્કુલની પાસે, ધુન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ. (સવારે ૦૮:૩૦ કલાકે)	શ્રી ઉપાબેન જાદવ ૯૯૯૯૬ ૩૭૦૬૨
૨	મધ્ય ઝોન	કબડ્ડી	૧૭-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ધી શાહપુર માધ્યમિક શાળા, આંબલીવાળી પાળ, શાહપુર, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી બાબુભાઈ પટેલ ૬૩૫૩૪ ૨૯૪૦૫ ૯૯૭૪૮ ૬૭૩૬૩
		યોગાસન	૧૭-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	આઈ. પી. મિશન હાઈસ્કૂલ (ભાઈઓ), રાયખડ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી જુમ્માભાઈ મલેક ૯૪૮૯૯ ૯૩૩૭૭
		ખો-ખો	૧૮-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	અંજુમનો ઈસ્લામ સ્કૂલ, ગોળ લીમડા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	
		ચેસ	૧૮-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	સેંટ એવિયર્સ સ્કૂલ, મિર્ઝાપુર, અમદાવાદ. (સવારે ૦૮:૩૦ કલાકે)	શ્રી બાબુભાઈ પટેલ ૬૩૫૩૪ ૨૯૪૦૫ ૯૯૭૪૮ ૬૭૩૬૩
		વોલીબોલ	૨૦-૦૧-૨૪	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)		

3	इशिता जोन	कम्प्यूटर	१६-०१-२४	भाईओ-बलेनो तमाम वयजूथ (परीपत्र मुज्ज्)	रमत संकुव भोभरा, इरुमाणीबिन लोडिपटवनी सामे, भोभरा, अमदावाद, (सवारि ०८:०० क्वाडि)	श्री भूपेन्द्रसिंह चौडाण ८८०४४ ५५८८८	
		भो-भो	१५-०१-२४	भाईओ-बलेनो तमाम वयजूथ (परीपत्र मुज्ज्)	रमत संकुव भोभरा, इरुमाणीबिन लोडिपटवनी सामे, भोभरा, अमदावाद, (सवारि ०८:०० क्वाडि)	श्री ओम. अंस. वसर ८८२५४ ३५२००	
		ररसाभ्य	१७-०१-२४	भाईओ-बलेनो तमाम वयजूथ (परीपत्र मुज्ज्)	रमत संकुव भोभरा, इरुमाणीबिन लोडिपटवनी सामे, भोभरा, अमदावाद, (सवारि ०८:०० क्वाडि)	श्री भूपेन्द्रसिंह चौडाण ८८०४४ ५५८८८	
		येस	१७-०१-२४	भाईओ-बलेनो तमाम वयजूथ (परीपत्र मुज्ज्)	रमत संकुव भोभरा, इरुमाणीबिन लोडिपटवनी सामे, भोभरा, अमदावाद, (सवारि ०८:०० क्वाडि)	श्री भूपेन्द्रसिंह चौडाण ८८०४४ ५५८८८	
	पूर्व जोन	अश्वेटीकस	१८-०१-२४	भाईओ-बलेनो तमाम वयजूथ (परीपत्र मुज्ज्)	अश्वेटीकस ट्रेक निकोव स्पोर्ट्स कोम्प्लेक्स, याणुक्य रकुवनी पासि, शुक्रन यार रस्ता पासे, निकोव-नरोडा रोड, निकोव, अमदावाद. (सवारि ८:०० क्वाडि)	श्री ओम. अंस. वसर ८८२५४ ३५२००	
			योगासन	२०-०१-२४	भाईओ-बलेनो तमाम वयजूथ (परीपत्र मुज्ज्)	रमत संकुव भोभरा, इरुमाणीबिन लोडिपटवनी सामे, भोभरा, अमदावाद, (सवारि ०८:०० क्वाडि)	श्री ओम. अंस. वसर ८८२५४ ३५२००
		वोवीबोव	१८-०१-२४	भाईओ-बलेनो तमाम वयजूथ (परीपत्र मुज्ज्)	रमत संकुव भोभरा, इरुमाणीबिन लोडिपटवनी सामे, भोभरा, अमदावाद, (सवारि ०७:३० क्वाडि)	श्री कनुभाई पटेव ८४२७३ २०५८८	
			येस	१६-०१-२४	भाईओ-बलेनो तमाम वयजूथ (परीपत्र मुज्ज्)	अश्वेटीकस ट्रेक निकोव स्पोर्ट्स कोम्प्लेक्स, याणुक्य रकुवनी पासि, शुक्रन यार रस्ता पासे, निकोव-नरोडा रोड, निकोव, अमदावाद. (सवारि ०७:३० क्वाडि)	श्री जगदिशसिंह चौडाण ८८२५१ ८७६८८ श्री विरेन्द्रसिंह भटौरिया ८४६०१ ८६१२८
	४	पूर्व जोन	अश्वेटीकस	१७-०१-२४	भाईओ-बलेनो तमाम वयजूथ (परीपत्र मुज्ज्)	रमत संकुव भोभरा, इरुमाणीबिन लोडिपटवनी सामे, भोभरा, अमदावाद, (सवारि ०७:३० क्वाडि)	श्री कनुभाई पटेव ८४२७३ २०५८८
			योगासन	१८-०१-२४	भाईओ-बलेनो तमाम वयजूथ (परीपत्र मुज्ज्)	रमत संकुव भोभरा, इरुमाणीबिन लोडिपटवनी सामे, भोभरा, अमदावाद, (सवारि ०७:३० क्वाडि)	श्री जगदिशसिंह चौडाण ८८२५१ ८७६८८
			वोवीबोव	१८-०१-२४	भाईओ-बलेनो तमाम वयजूथ (परीपत्र मुज्ज्)	रमत संकुव भोभरा, इरुमाणीबिन लोडिपटवनी सामे, भोभरा, अमदावाद, (सवारि ०७:३० क्वाडि)	श्री विरेन्द्रसिंह भटौरिया ८४६०१ ८६१२८
			कम्प्यूटर	१८-०१-२४	भाईओ-बलेनो तमाम वयजूथ (परीपत्र मुज्ज्)	रमत संकुव भोभरा, इरुमाणीबिन लोडिपटवनी सामे, भोभरा, अमदावाद, (सवारि ०७:३० क्वाडि)	श्री कनुभाई पटेव ८४२७३ २०५८८

૫	પશ્ચિમ ઝોન	કમ્પ્લેટી	૧૬-૦૧-૨૪	બાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	રમત સંકુલ ખોખરા, રૂક્મણીબેન લોશિપટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી યસભાઈ ૮૮૬૬૩ ૬૬૩૩૩
		ખો-ખો	૧૬-૦૧-૨૪	બાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	નવરંગ સ્કૂલ, નવરંગપુરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી અશ્વિનભાઈ પટેલ ૭૮૧૮૮ ૩૮૩૮૭
		કમ્પ્લેટી	૧૭-૦૧-૨૪	બાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	રમત સંકુલ ખોખરા, રૂક્મણીબેન લોશિપટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી યસભાઈ ૮૮૬૬૩ ૬૬૩૩૩
		ખો-ખો	૧૭-૦૧-૨૪	બાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	નવરંગ સ્કૂલ, નવરંગપુરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી અશ્વિનભાઈ પટેલ ૭૮૧૮૮ ૩૮૩૮૭
		રસ્સાખેંચ	૨૩-૦૧-૨૪	બાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગુજરાત કુમાર વિનય મંદિર, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી અશ્વિનભાઈ પટેલ ૭૮૧૮૮ ૩૮૩૮૭
		ચેસ	૧૨-૦૧-૨૪	બાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ટિવાઈન લાઈફ સ્કૂલ, વાસણા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી મેહુલ શાહ ૯૯૨૫૨ ૭૦૨૩૯
	પૂર્વ ઝોન	યોગાસન	૨૪-૦૧-૨૪	બાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ડી.પી. હાઈસ્કૂલ, નવા વાહજ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી હરજીન્દર ગીલ ૯૩૭૬૧ ૨૨૯૮૪
		એથલેટીક્સ	૧૮-૦૧-૨૪	બાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગુજરાત યુનિવર્સિટી એથલેટીક ટ્રેક, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી પ્રદ્યુમનસિંહ ચૌહાણ ૯૬૦૧૦ ૧૦૭૦૩
		વોલીબોલ	૧૯-૦૧-૨૪	બાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગુજરાત વિદ્યાપીઠ, ઈન્કમેટેલ ચાર રસ્તા પાસે, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી આર. કે. પટેલ (૯૭૨૩૭ ૬૬૬૧૦)
		કમ્પ્લેટી	૧૧-૦૧-૨૪	બાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	જયોત્સ્નાબેન પટેલ ૭૮૧૮૮ ૭૦૫૦૦
		ખો-ખો	૧૧-૦૧-૨૪	બાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	સાર્વજનિક સ્કૂલ, સરખેજ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી ઈરફાન પાઠાપાહીવાલા ૯૩૭૭૯ ૬૬૬૭૪
		રસ્સાખેંચ	૧૧-૦૧-૨૪	બાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ગુજરાત યુનિવર્સિટી એથલેટીક ટ્રેક, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી હરજીન્દર ગીલ ૯૩૭૬૧ ૨૨૯૮૪
૬	નવા પશ્ચિમ ઝોન	વોલીબોલ	૧૩-૦૧-૨૪	બાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ટિલ્પપથ કેમ્પસ, મેમનગર, અમદાવાદ. (બપોરે ૧૨:૦૦ કલાકે)	શ્રી હરજીન્દર ગીલ ૯૩૭૬૧ ૨૨૯૮૪
		એથલેટીક્સ	૧૬-૦૧-૨૪	બાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ટિલ્પપથ કેમ્પસ, મેમનગર, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી હરજીન્દર ગીલ ૯૩૭૬૧ ૨૨૯૮૪
		યોગાસન	૧૬-૦૧-૨૪	બાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ટિલ્પપથ કેમ્પસ, મેમનગર, અમદાવાદ. (બપોરે ૧૨:૦૦ કલાકે)	શ્રી હરજીન્દર ગીલ ૯૩૭૬૧ ૨૨૯૮૪
		ચેસ	૧૮-૦૧-૨૪	બાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ટિલ્પપથ કેમ્પસ, મેમનગર, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી હરજીન્દર ગીલ ૯૩૭૬૧ ૨૨૯૮૪
		કમ્પ્લેટી	૧૧-૦૧-૨૪	બાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ટિલ્પપથ કેમ્પસ, મેમનગર, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી હરજીન્દર ગીલ ૯૩૭૬૧ ૨૨૯૮૪
		ખો-ખો	૧૧-૦૧-૨૪	બાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	ટિલ્પપથ કેમ્પસ, મેમનગર, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી હરજીન્દર ગીલ ૯૩૭૬૧ ૨૨૯૮૪

નોંધ: સ્પર્ધા સ્થળે પહોંચના પહેલાં ૬૦ મિનિટ પહેલાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે.

ખેલ મહાકુંભ 2.0 મહાનગરપાલિકાકક્ષા (અમદાવાદ શહેર) સ્પર્ધા સમયપત્રક

ક્રમ નં.	સ્પર્ધા નામ	વય જૂથ	તારીખ	સ્થળનું નામ	કન્વીનરશ્રીનું નામ
૧	જુડો	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૨૦-૦૧-૨૪	સ્મત સંકુલ ખોખરા, રૂક્મણીબિન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી અખતર અંસારી ૯૩૭૪૧ ૬૩૭૩૦ શ્રી અનિતા વાલવડકર ૯૭૧૪૭ ૫૫૫૦૭
		બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૨૧-૦૧-૨૪		
૨	બેડમિન્ટન	ઓપન એન્ડ (ભાઈઓ અને બહેનો)	૨૧-૦૧-૨૪	સ્મત સંકુલ ખોખરા, રૂક્મણીબિન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી શિવાંગ શુક્લા ૯૩૨૮૨ ૪૫૧૫૯
		અં - ૧૧ (ભાઈઓ અને બહેનો)	૨૨-૦૧-૨૪		
		અં - ૧૪ (ભાઈઓ અને બહેનો)	૨૩-૦૧-૨૪		
		અં - ૧૭ (ભાઈઓ અને બહેનો)	૨૪-૦૧-૨૪		
		૪૦ વર્ષથી ઉપર, ૬૦ વર્ષથી ઉપર (ભાઈઓ અને બહેનો)	૧૧-૦૨-૨૪ ૧૨-૦૨-૨૪		
૩	રગ્બી	રગ્બી સ્પર્ધાનું ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલ ટીમોએ તા. ૧૭/૦૧/૨૦૨૪ સુધી નિકોલ સ્પોર્ટ્સ હોસ્ટેલ, ચાણુક્ય સ્કૂલની સામે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ ખાતે મોકલી આપવાની રહેશે. એન્ટ્રી આપવા માટે શ્રી ધવલ પારધી, મો.નં.: ૯૮૨૫૫ ૧૯૬૫૭ નો સંપર્ક કરવાનો રહેશે. એન્ટ્રી આપવા માટે સમય સવારે ૧૦:૩૦ કલાક થી સાંજે ૦૬:૩૦ કલાક સુધીમાં જાહેર રજના દિવસો સિવાય મોકલી આપવાની રહેશે. સ્પર્ધાની તારીખ અને સ્થળની એન્ટ્રી મળે થી જાણ કરવામાં આવશે.			
		આર્ચરી	સંસ્કારધામ સ્કુલ કેમ્પસ, ગોધાવી ગામ, તા. સાણંદ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી ધરકીયાભાઈ ભીલ ૯૪૦૮૪ ૧૮૫૧૧	
૪	સ્કેટીંગ	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૨૦-૦૧-૨૪	સ્મત સંકુલ ખોખરા, રૂક્મણીબિન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી ધરકીયાભાઈ ભીલ ૯૪૦૮૪ ૧૮૫૧૧
		બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૨૦-૦૧-૨૪		
૫	સ્કેટીંગ	સ્કેટીંગ સ્પર્ધાનું ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલ ખેલાડીએ તા. ૧૭/૦૧/૨૦૨૪ સુધી નિકોલ સ્પોર્ટ્સ હોસ્ટેલ, ચાણુક્ય સ્કૂલની સામે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ ખાતે મોકલી આપવાની રહેશે. એન્ટ્રી આપવા માટે શ્રી રેનીસન મેકવાન, મો.નં.: ૯૭૨૫૪ ૯૭૮૭૧ નો સંપર્ક કરવાનો રહેશે. એન્ટ્રી આપવા માટે સમય સવારે ૧૦:૩૦ કલાક થી સાંજે ૦૬:૩૦ કલાક સુધીમાં જાહેર રજના દિવસો સિવાય મોકલી આપવાની રહેશે. સ્પર્ધાની તારીખ અને સ્થળની એન્ટ્રી મળે થી જાણ કરવામાં આવશે.			
		સ્કેટીંગ	૧૧-૦૨-૨૪ ૧૨-૦૨-૨૪	શ્રી ઠયાબેન જાદવ ૯૮૯૯૬ ૭૩૦૬૨	

૭	યોગાસન	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૧૧-૦૨-૨૪	દિવ્યાપય કેમ્પસ, (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી હરજીન્દર ગીલ ૯૩૭૬૧ ૨૨૯૮૪ મેથાનાબા ઝાલા ૯૭૨૭૫ ૦૮૧૦૨ વિધી પટેલ
૮	ચેસ	ભાઈઓ-બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૧૯-૦૧-૨૪ ૨૦-૦૧-૨૪	નરોડા સ્પોર્ટ્સ હોસ્ટેલ, યાણક્ય સ્કૂલની સામે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૮૧૬૦૩ ૩૪૫૭૩
૯	ટેકવોન્ડો	અં-૧૪ (ભાઈઓ-બહેનો) અં-૧૭ (ભાઈઓ-બહેનો) ઓપન એજ ગ્રુપ (ભાઈઓ-બહેનો) અં-૧૧,૧૪ ભાઈઓ અને બહેનો અં-૧૭ ભાઈઓ અને બહેનો	૨૧-૦૧-૨૪ ૨૨-૦૧-૨૪ ૨૩-૦૧-૨૪ ૧૬-૦૧-૨૪ ૧૭-૦૧-૨૪	તાલુકા રમત સંકુલ બીબીપુર, વાંચ ગામ, રોડ, બીબીપુર, તાન્દરકોઈ, અમદાવાદ. (સવારે ૮:૦૦ કલાકે)	શ્રી નિતેશ ચાનાબંડ ૯૬૦૧૪ ૬૬૪૮૫
૧૦	લોન ટેનીસ	ઓપન એજ ગ્રુપ ભાઈઓ અને બહેનો સિંગલ્સ ઓપન એજ ગ્રુપ ભાઈઓ અને બહેનો ડબલ્સ અને સિક્સ ડબલ્સ ૪૦ વર્ષથી ઉપર ભાઈઓ અને બહેનો અને ૬૦ વર્ષથી ઉપર ભાઈઓ અને બહેનો સિંગલ્સ ૪૦ વર્ષથી ઉપર ભાઈઓ અને બહેનો અને ૬૦ વર્ષથી ઉપર ભાઈઓ અને બહેનો ડબલ્સ અને સિક્સ ડબલ્સ	૧૯-૦૧-૨૪ ૨૦-૦૧-૨૪ ૨૧-૦૧-૨૪	રમત સંકુલ ખોખરા, રૂક્માણીબિન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી અનિલ માડ ૯૯૨૪૨ ૫૭૮૨૦
૧૧	સ્વીમીંગ	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ) બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૧૭-૦૧-૨૪ ૧૮-૦૧-૨૪	સરદાર પટેલ સ્વીમીંગ પૂલ, નવરંગપુરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી મેહુલ સિસ્ત્રી ૮૧૨૮૮ ૯૬૭૯૯
૧૨	આર્ટિસ્ટીક સ્કેટીંગ	આર્ટિસ્ટીક સ્કેટીંગ રમતના ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલ ખેલાડીએ તા. ૧૭/૦૧/૨૦૨૪ સુધી નિકોલ સ્પોર્ટ્સ હોસ્ટેલ, યાણક્ય સ્કૂલની સામે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ ખાતે મોકલી આપવા માટે શ્રી હાર્દિક મકવાણા, મો.નં.: ૯૦૧૬૬ ૪૬૨૧૩ નો સંપર્ક કરવાનો રહેશે. એન્ટ્રી આપવા માટે સમય સવારે ૧૦:૩૦ કલાક થી સાંજે ૦૬:૩૦ કલાક સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય મોકલી આપવાની રહેશે. આર્ટિસ્ટીક સ્કેટીંગ રમતના ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલ ખેલાડીએ તા. ૧૭/૦૧/૨૦૨૪ સુધી નિકોલ સ્પોર્ટ્સ હોસ્ટેલ, યાણક્ય સ્કૂલની સામે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ ખાતે મોકલી આપવાની રહેશે. એન્ટ્રી આપવા માટે શ્રી રેનીસન મેકવાન, મો.નં.: ૯૭૨૫૪ ૯૭૮૭૧ નો સંપર્ક કરવાનો રહેશે. એન્ટ્રી આપવા માટે સમય સવારે ૧૦:૩૦ કલાક થી સાંજે ૦૬:૩૦ કલાક સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય મોકલી આપવાની રહેશે. સ્પર્ધાની તારીખ અને સ્થળની એન્ટ્રી મળે થી જાણ કરવામાં આવશે.	૧૭-૦૧-૨૪ ૧૮-૦૧-૨૪	આર્ટિસ્ટીક સ્કેટીંગ રમતના ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલ ખેલાડીએ તા. ૧૭/૦૧/૨૦૨૪ સુધી નિકોલ સ્પોર્ટ્સ હોસ્ટેલ, યાણક્ય સ્કૂલની સામે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ ખાતે મોકલી આપવાની રહેશે. એન્ટ્રી આપવા માટે શ્રી રેનીસન મેકવાન, મો.નં.: ૯૭૨૫૪ ૯૭૮૭૧ નો સંપર્ક કરવાનો રહેશે. એન્ટ્રી આપવા માટે સમય સવારે ૧૦:૩૦ કલાક થી સાંજે ૦૬:૩૦ કલાક સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય મોકલી આપવાની રહેશે. સ્પર્ધાની તારીખ અને સ્થળની એન્ટ્રી મળે થી જાણ કરવામાં આવશે.	

૧૩	કુસ્તી	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૨૨-૦૧-૨૦૨૪	રમત સંકુલ ખોખરા, રૂક્મણીબેન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી વિરેન્દ્રસિંહ ભટ્ટોશિયા ૮૪૬૦૧ ૯૬૧૨૯ શ્રી મોનિકા તારાવંદ ૯૩૨૦૧ ૫૦૮૦૯
૧૪	ખો-ખો	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ) બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૨૦-૦૧-૨૪ ૨૧-૦૧-૨૪	નિકોલ રમત સંકુલ, યાણકમ સ્કૂલની બાજુમાં, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ, અમદાવાદ.	શ્રી રીટાબેન કણુશરીયા ૯૯૧૩૭ ૧૬૨૧૭
૧૫	કરાટે	કરાટે રમતના ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલ ખેલાડીએ તા. ૨૦/૦૧/૨૦૨૪ સુધી નિકોલ સ્પોર્ટ્સ હોસ્ટેલ, યાણકમ સ્કૂલની સામે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ ખાતે મોકલી આપવાની રહેશે. એન્ટ્રી આપવા માટે શ્રી મીત પ્રજાપતિ, મો.નં.: ૯૬૩૮૧ ૨૯૮૯૭ નો સંપર્ક કરવાનો રહેશે. એન્ટ્રી આપવા માટે સમય સવારે ૧૦:૩૦ કલાક થી સાંજે ૦૬:૩૦ કલાક સુધીમાં જાહેર રજના દિવસો સિવાય મોકલી આપવાની રહેશે. સ્પર્ધાની તારીખ અને સ્થળની એન્ટ્રી મળે થી જાણ કરવામાં આવશે.			
૧૬	વોલીબોલ	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૨૪-૦૧-૨૪	ગુજરાત વિદ્યાપીઠ, ઈન્કમેટેક્સ ચાર રસ્તા પાસે, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી આર કે પટેલ ૯૭૨૩૭ ૬૬૬૧૦
૧૭	હેન્ડબોલ	ભાઈઓ તમામ વયજૂથ (પરીપત્ર મુજબ) બહેનો તમામ વયજૂથ (પરીપત્ર મુજબ)	૧૩-૦૨-૨૪ ૧૪-૦૨-૨૪	રાજપૂત સમાજ ભવન, ગોતા ઓગણજી રોડ, એસ.જી. હાઈવે, ગોતા ગ્રીજ નીચે, ગોતા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી પ્રદ્યુમનસિંહ ચૌહાણ ૯૬૦૧૦ ૧૦૭૦૩ શ્રી અનિરુદ્ધ દેસાઈ ૯૬૦૧૬ ૬૫૭૭૦
૧૮	ફૂટબોલ	ફૂટબોલ રમતના ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલ ટીમોએ તા. ૧૭/૦૧/૨૦૨૪ સુધી નિકોલ સ્પોર્ટ્સ હોસ્ટેલ, યાણકમ સ્કૂલની સામે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ ખાતે મોકલી આપવાની રહેશે. એન્ટ્રી આપવા માટે શ્રી દેવાંગ મિસ્ત્રી, મો.નં.: ૯૭૨૭૧ ૧૯૮૩૫ નો સંપર્ક કરવાનો રહેશે. એન્ટ્રી આપવા માટે સમય સવારે ૧૦:૩૦ કલાક થી સાંજે ૦૬:૩૦ કલાક સુધીમાં જાહેર રજના દિવસો સિવાય મોકલી આપવાની રહેશે. સ્પર્ધાની તારીખ અને સ્થળની એન્ટ્રી મળે થી જાણ કરવામાં આવશે.			
૧૯	ટેબલ ટેનીસ	૪૦ વર્ષથી ઉપર, ૬૦ વર્ષથી ઉપર (ભાઈઓ અને બહેનો) અં-૧૧, અં-૧૪, અં-૧૭ ભાઈઓ-બહેનો ઓપન એલ યુપ ભાઈઓ-બહેનો	૧૩-૦૨-૨૦૨૪ ૧૫-૦૨-૨૦૨૪ ૧૭-૦૨-૨૦૨૪	રમત સંકુલ ખોખરા, રૂક્મણીબેન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી કુશલ સંગતાળી ૯૯૧૩૭ ૨૯૦૦૪
૨૦	કબડ્ડી	અં-૧૪, ૧૭ બહેનો અં-૧૪ ભાઈઓ અને ઓપન એલ યુપ બહેનો અં-૧૭, ઓપન એલ યુપ ભાઈઓ	૨૪-૦૧-૨૦૨૪ ૨૫-૦૧-૨૦૨૪ ૨૬-૦૧-૨૦૨૪	નિકોલ રમત સંકુલ, યાણકમ સ્કૂલની બાજુમાં, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ, અમદાવાદ. (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી કમલા પાલ ૯૪૫૧૨ ૨૧૯૨૩ શ્રી કનુભાઈ પટેલ ૯૪૨૭૩ ૨૦૫૯૯

૨૧	શુદ્ધીંગ બોલ	ઓપન એન્જ બાર્ડિઓ ૪૦ વર્ષથી ઉપર બાર્ડિઓ	૦૮-૦૨-૨૦૨૪ ૦૯-૦૨-૨૦૨૪	સફર ફાર્મ, વિશાલા હોટલની પાસે, નારોલ રોડ, અમદાવાદ (સાંજે ૦૬:૦૦ કલાકે)	શ્રી ઈરફાન પાટાપાડીવાલા ૯૩૭૭૯ ૬૬૬૭૪
૨૨	બારકેટ બોલ	બારકેટ બોલ સ્પર્ધાના ખેલ મહાકુંભમાં રહસ્ટ્રેશન ફાવેલ ટીમોએ તા. ૧૭/૦૧/૨૦૨૪ સુધી નિકોલ સ્પોર્ટ્સ હોસ્ટેલ, ચાણક્ય સ્કૂલની સામે, યુક્રન ચાર રસ્તા પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ ખાતે મોકલી આપવાની રહેશે. એન્ટ્રી આપવા માટે શ્રી મીત પ્રજ્ઞપતિ, મો. નં.: ૯૬૩૮૧ ૨૯૯૯૭ નાં સંપર્ક કરવાનો રહેશે. એન્ટ્રી આપવા માટે સમય સવારે ૧૦:૩૦ કલાક થી સાંજે ૦૬:૩૦ કલાક સુધીમાં જાહેર રજના દિવસો સિવાય મોકલી આપવાની રહેશે. સ્પર્ધાની તારીખ અને સ્થળની એન્ટ્રી મળે થી જાણ કરવામાં આવશે.			
૨૩	હોકી	અં - ૧૪ (બાર્ડિઓ અને જાહેનો) અં - ૧૭ (બાર્ડિઓ અને જાહેનો) ઓપન એન્જ ગ્રુપ (બાર્ડિઓ-જાહેનો)	૨૦-૦૧-૨૦૨૪ ૨૧-૦૧-૨૦૨૪ ૨૨-૦૧-૨૦૨૪	સંદ અવિવક્તે લાપોલા સ્કુલ, મેમનગર, અમદાવાદ (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી માઈકલ પાંલ ૮૮૪૯૭ ૧૧૧૭૪૮
૨૪	એથલેટીક્સ	બાર્ડિઓ તમામ વયગ્રુપ (૫૫થીવય સુધી) જાહેનો તમામ વયગ્રુપ (૫૫થીવય સુધી)	૧૧-૦૨-૨૪ ૧૨-૦૨-૨૪	એલેક્ટ્રીકલ ટ્રેક, નિકોલ રમત સંકુલ, ચાણક્ય સ્કૂલની ખાજુલા, યુક્રન ચાર રસ્તા પાસે, નિકોલ, અમદાવાદ, (સવારે ૦૮:૦૦ કલાકે)	શ્રી રણધીરસિંહ ગોહીલ ૯૯૭૯૧ ૪૧૦૦૪ મુખેન્દ્રસિંહ ચૌહાણ ૯૯૦૪૪ ૫૫૯૯૯ શ્રી નિરંજન ચોરસીયા ૯૯૨૩૩ ૯૧૧૧૬ શ્રી જયદીપા કામોર ૯૯૩૭૯ ૪૮૧૧૬

નોંધ: સ્પર્ધા સ્થળે પહોંચતા પહેલાં કન્વીનરશ્રીનો સંપર્ક ફરજિયાત કરી લેવો.

૧. શાળા અને ગ્રામ્યકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ	વયજૂથ	સ્મત
૧	૯ વર્ષથી નીચે	૩૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
૨	૧૧ વર્ષથી નીચે	૫૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
૩	૧૪ વર્ષથી નીચે	એથલેટીક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૪	૧૭ વર્ષથી નીચે	એથલેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૫	ઓપન એજ ગ્રુપ	એથલેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૬	૪૦ વર્ષથી ઉપર	રસ્સાખેંચ
૭	૬૦ વર્ષથી ઉપર	રસ્સાખેંચ

૨. તાલુકાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ	વયજૂથ	સ્મત
૧	૧૧ વર્ષથી નીચે	ચેસ
૨	૧૪ વર્ષથી નીચે	એથલેટીક્સ, ચેસ, યોગાસન
૩	૧૭ વર્ષથી નીચે	એથલેટીક્સ, ચેસ, યોગાસન
૪	ઓપન એજ ગ્રુપ	એથલેટીક્સ, ચેસ, યોગાસન
૫	૪૦ વર્ષથી ઉપર	ચેસ
૬	૬૦ વર્ષથી ઉપર	ચેસ

૩. જિલ્લાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ	વયજૂથ	સ્મત
૧	૧૧ વર્ષથી નીચે	એથલેટીક્સ, સ્વીમીંગ, સ્કેટીંગ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમિન્ટન
૨	૧૪ વર્ષથી નીચે	સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, કરાટે, આર્ટિસ્ટીક સ્કેટીંગ
૩	૧૭ વર્ષથી નીચે	સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, યોગાસન, કરાટે, રગ્બી
૪	ઓપન એજ ગ્રુપ	સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, શુટીંગબોલ, કરાટે, યોગાસન, રગ્બી, આર્ટિસ્ટીક સ્કેટીંગ
૫	૪૦ વર્ષથી ઉપર	બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ, શુટીંગબોલ
૬	૬૦ વર્ષથી ઉપર	બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ

૪. સીધી રાજ્યકક્ષાએ યોજાતી સ્પર્ધાઓ

ક્રમ	વયજુથ	રમત
૧	૧૧ વર્ષથી નીચે	સ્વીમીંગ, સ્કેટીંગ
૨	૧૪ વર્ષથી નીચે	એથલેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્યરી, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, ટેકવોન્ડો, જિમ્નાસ્ટીક્સ, સ્કેટીંગ, મલખમ્બ, સ્પોર્ટ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ
૩	૧૭ વર્ષથી નીચે	એથલેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્યરી, ટેકવોન્ડો, વેઈટલીફ્ટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, જિમ્નાસ્ટીક્સ, સ્કેટીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ, વુડબોલ
૪	ઓપન એજ ગ્રુપ	એથલેટીક્સ, સ્વીમીંગ, ટેકવોન્ડો, જુડો, કુસ્તી, આર્યરી, જિમ્નાસ્ટીક્સ, સાયકલિંગ (૨૦ કિ.મી.), શુટીંગ, સ્કેટીંગ, વેઈટલીફ્ટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ ક્લાઈમીંગ, ઘોડેસવારી, વુડબોલ, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ
૫	૪૦ અને ૬૦ વર્ષથી ઉપર	યોગાસન

(૮) સ્પર્ધા અંગેની સુચનાઓ :-

- ખેલ મહાકુંભમાં માત્ર જન્મ તારીખને ધ્યાનમાં રાખવાની રહેશે. અને કોઈ પણ રમતવીર સ્પર્ધામાં ભાગ લઈ શકશે તેમાં ધોરણને ધ્યાનમાં લેવાનું રહેશે નહીં.
- ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી તમામ સ્પર્ધાઓમાં માત્ર જન્મ તારીખના આધારે કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે.
- એથલેટીક્સ (ઓપન એજ ગ્રુપ):- જિલ્લાકક્ષાની સ્પર્ધામાં યોજનાર વ્યક્તિગત ઈવેન્ટમાંથી પસંદગી સમિતિ દ્વારા પસંદ થયેલ ખેલાડીઓની ૪ X ૧૦૦ મી. રીલેની એથલેટીક્સ ટીમ બનાવવાની રહેશે જે રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.
- એથલેટીક્સ રમતમાં વધુમાં વધુ બે વ્યક્તિગત અને એક રીલે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.

(SGFIના નિયમ મુજબ)

- સ્વીમીંગ (ઓપન એજ (સિનિયર) ગ્રુપ) :-
 - જિલ્લાકક્ષાની સ્પર્ધામાં યોજનાર વ્યક્તિગત ઈવેન્ટમાંથી પસંદગી સમિતિ દ્વારા પસંદ થયેલ ખેલાડીઓની ૪ X ૧૦૦ મી. ફ્રી સ્ટાઈલ રીલે ટીમ બનાવવાની રહેશે જે રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
 - ૪ X ૧૦૦ મી ફ્રી સ્ટાઈલ રીલેની ટીમ જિલ્લાકક્ષાએ ટ્રાયલ લઈ શ્રેષ્ઠ ટીમ પસંદ કરી રાજ્યકક્ષાએ મોકલવાની રહેશે અને ટીમની પસંદગી જિલ્લાકક્ષાની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે.
- સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કુટ ઓફ ડેટ ૩૧/૧૨/૨૦૨૩ રહેશે.
- સીધી રાજ્યકક્ષાએ શરૂ થતી સ્પર્ધા માટે ઉપસ્થિત રહેનાર ખેલાડીઓની સૌ પ્રથમ ક્વોલીફાઈડ મેચનું પ્રથમ રાઉન્ડનું આયોજન ગોઠવવાનું રહેશે. સ્પર્ધામાં ઉપસ્થિત રહેનાર ખેલાડીઓને એક ટાઈમ લંચ આપવાનો રહેશે. માત્ર પ્રથમ રાઉન્ડના વિજેતાઓને જો રોકવાની જરૂરી જણાય તો ભોજન અને નિવાસ પુરું પાડવાનું રહેશે.

- રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પ્રથમ દિવસે સાંજે રીપોર્ટિંગ કરવા માટે જાણાવવાનું રહેશે. અને નિવાસ તેમજ ભોજન વ્યવસ્થા કરવાની રહેશે.
- શાળા/ગ્રામ્યકક્ષાએ થી તાલુકાકક્ષા, તાલુકાકક્ષાએ થી જિલ્લાકક્ષા અને જિલ્લાકક્ષાએ થી ઝોનકક્ષા/રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા વિજેતા ખેલાડીઓની એન્ટ્રી ઓનવાઈન મોકલી આપવાની રહેશે. ઓનવાઈન એન્ટ્રી વગર કોઈ પણ સ્પર્ધકને ઉપરની કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે નહીં.
- સ્પર્ધામાં ભાગ લેવા માટેની વયજુથ પ્રમાણેની રમતો, વજન ગૃપ તેમજ ઈવેન્ટની માહિતી ઓનવાઈન રજિસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવેલ હોય તે મુજબ ખેલાડીએ ભાગ લેવાનો રહેશે.
- ચેસની સ્પર્ધા સીધી તાલુકા કક્ષાએથી શરૂ કરવાની રહેશે. આ સુચના મહાનગરપાલીકાને પણ લાગુ પડશે. જેની નોંધ લેવી.
- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની એકેડમીના તમામ ખેલાડીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી સ્પર્ધાઓ પૈકી સીધી સીધો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. પરંતુ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે.
- જે તે કક્ષાની સ્પર્ધાઓ દરમ્યાન જે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, સરકારશ્રી માન્ય જે તે રમતના ફેડરેશન/એસોસીએશનની સ્પર્ધામાં ખરેખર ભાગ લીધેલ હોય અને રજિસ્ટ્રેશન કરાવેલ હોય તેવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, સરકારશ્રી માન્ય જે તે રમતના ફેડરેશન/એસોસીએશનની સ્પર્ધામાં ખરેખર ભાગ લીધેલ હોવા અંગેના પુરાવાની ચકાસણી કરી સંબંધિત ખેલાડીની બાંહેધરી મેળવીને આગળની જે તે કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. પરંતુ ઈન્વીટેશન સ્પર્ધાને માન્ય રાખવાની રહેશે નહીં.
- ખેલાડીથી શરત ચુકથી ખરેખર પોતાની વયજુથ કરતાં અન્ય વયજુથમાં રજિસ્ટ્રેશન થઈ ગયેલ હોય તો કટ ઓફ ડેટને ધ્યાને રાખી ખરેખર જે વયજુથમાં રમવા માટે લાયકાત ધરાવતા હોય તે વયજુથમાં ભાગ લઈ શકશે તેની ચકાસણી જિલ્લા રમત વિકાસ અધિકારી/ જિલ્લા રમત ગમત અધિકારીએ કરવાની રહેશે.
- રજિસ્ટ્રેશન અને સ્પર્ધા સમયે જે તે ખેલાડીના વજનમાં આંશિક ફેરફાર હોય તો તે ખેલાડીને જે તે સ્પર્ધા સમયે જે વજન હોય તે વજન ગૃપમાં ભાગ લઈ શકશે. સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા રમત વિકાસ અધિકારી/જિલ્લા રમત ગમત અધિકારીએ નિર્ણય કરવાનો રહેશે.
- જે તે કક્ષાની સ્પર્ધા શરૂ થાય તે પહેલા નાદુરસ્ત, અશક્ત વિધાર્થીઓ તેમજ રમતવીરો સ્પર્ધામાં ભાગ ન લે તેની તકેદારી ટીમ મેનેજર અને કોચે રાખવાની રહેશે.
- તાલુકા, જિલ્લા અને ઝોન/રાજ્યકક્ષાની સ્પર્ધાઓ દરમ્યાન પ્રાથમિક સારવાર માટે મેડીકલ ટીમ હાજર રાખવાની રહેશે.
- ખેલ મહાકુંભ અંતર્ગત દૈનિક સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતી પ્રેસનોટની કટીંગ કચેરી ખાતે રાખવાની રહેશે. અને સ્પર્ધા અંતે તમામ નકલો અત્રેની કચેરીએ મોકલી આપવાની રહેશે. નકારાત્મક મિડિયા કવરેજ તેમજ કોઈ અનિચ્છનિય ઘટના/બનાવ અંગે તાત્કાલિક હકીકતલક્ષી અહેવાલ અત્રેની કચેરીને મોકલી આપવાનો રહેશે.
- ખેલ મહાકુંભ અંતર્ગત ગ્રામ્ય/તાલુકા/જિલ્લા/મહાનગરપાલિકા/ઝોન અને રાજ્યકક્ષાની સ્પર્ધામાં કોઈ "SUCCESS STORY" હોઈ અને સ્થાનિક અખબારમાં પ્રસિદ્ધ થયેલ હોય/લોકલ ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલ હોય અને સ્પર્ધા દરમ્યાન વિડીયો રેકોર્ડિંગ થયેલ તેની જણ અત્રેની કચેરીને કરવાની રહેશે.

- પસંદગી ટીમમાં પ્રતિભાશાળી ખેલાડીઓને તક
 - ઘણી શાળાઓ ટીમનું રજિસ્ટ્રેશન કરતાં નથી. ટીમ બની શકે તેટલી સંખ્યામાં ખેલાડીઓ હોતા નથી તેવા કિસ્સામાં શાળાના ૨ થી ૩ ઉત્કૃષ્ટ અને પ્રતિભાશાળી ખેલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકતાં નથી.
 - પસંદગી સમિતિ દ્વારા યોગ્ય જણાય તો જિલ્લાકક્ષાએ “પસંદગી ટીમ” માટે ઉત્કૃષ્ટ અને પ્રતિભાશાળી ખેલાડીઓને ટીમ ટ્રાયલ માટે તક આપવાની રહેશે.
 - ખેલાડીએ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવેલ હોવું જોઈએ.
- શાળા/ગ્રામ્યમાંથી તાલુકા/ઝોન કક્ષાની સ્પર્ધામાં
 - વ્યક્તિગત રમતમાં વિજેતા પ્રથમ, દ્વિતિય અને તૃત્તિય સ્થાન મેળવેલ ખેલાડીઓ ભાગ લેશે.
 - ટીમ રમતમાં વિજેતા પ્રથમ, દ્વિતિય અને તૃત્તિય સ્થાન મેળવેલ ટીમો ખેલાડીઓ ભાગ લેશે.
- તાલુકા/ઝોનકક્ષામાંથી જિલ્લા/મહાનગરપાલીકાકક્ષાની સ્પર્ધામાં
 - વ્યક્તિગત રમતમાં વિજેતા પ્રથમ અને દ્વિતિય સ્થાન મેળવેલ ખેલાડીઓ ભાગ લેશે.
 - જ્યારે, ટીમ રમતમાં પ્રથમ અને દ્વિતિય સ્થાન મેળવેલ ૨ ટીમો ભાગ લેશે.
- જિલ્લાકક્ષામાંથી ઝોનકક્ષા (રાજ્યકક્ષા) ની સ્પર્ધામાં ટીમ રમતમાં માત્ર પસંદગી પામેલ એક જ ટીમ ઝોનકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે.
- જિલ્લાકક્ષામાંથી રાજ્યકક્ષાની સ્પર્ધામાં વ્યક્તિગત રમતમાં પ્રથમ અને દ્વિતિય વિજેતા ખેલાડી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
- ઝોનકક્ષા (રાજ્યકક્ષા)ની સ્પર્ધામાંથી પ્રત્યેક ઝોનમાંથી પ્રથમ અને દ્વિતિય વિજેતા ટીમોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મોકલવાની રહેશે.
- ઝોનકક્ષાની સ્પર્ધા નોકઆઉટ પધ્ધતિથી રમાડવાની રહેશે.
- રાજ્યકક્ષાની સ્પર્ધા નોકઆઉટ કમ લીગ પધ્ધતિથી રમાડવાની રહેશે.

(૨૨) સ્પર્ધાના સામાન્ય નિયમો :-

- ખેલ મહાકુંભમાં યોજવામાં આવતી તમામ સ્પર્ધાઓ જે તે રમતના ભારતના માન્ય ફેડરેશન/એસોસીએશનના નીતિ નિયમો તેમજ ખેલ મહાકુંભના વખતો વખત થયેલા સુધારા સાથેના સામાન્ય નિયમો મુજબ યોજવાની રહેશે.
- જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ. જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ.
- રજિસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે. જન્મ તારીખ ખોટી દર્શાવી રજિસ્ટ્રેશન થયેલ હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ૩ વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં.
- કોઈ પણ રમતવીર કોઈ પણ એક જિલ્લામાંથી એક અથવા બે જ રમતમાં ભાગ લઈ શકશે.
- દરેક સ્પર્ધા નિયત કાર્યક્રમ પ્રમાણે યોજવાની રહેશે.
- રજિસ્ટ્રેશનની કોઈ પણ સમસ્યા બાબતે રાજ્ય સ્તરે ટોલ ફ્રી નંબર. ૧૮૦૦૨૭૪૬૧૫૧ ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે.

- ખેલ મહાકુંભમાં સ્વીર્મીંગ ભાઈઓ/બહેનોની સ્પર્ધા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ હોય અને તે પૈકી ગમે તે એક વ્યક્તિગત ઈવેન્ટમાં જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેવા ખેલાડીઓને જિલ્લાકક્ષાની સ્પર્ધાની ઈવેન્ટ અને સીધી રાજ્યકક્ષાએ યોજાતી સ્પર્ધા મળીને એમ કુલ ત્રણ વ્યક્તિગત ઈવેન્ટ અને બે રીલેમાં ભાગ લઈ શકશે. જિલ્લાકક્ષાની કેટલી વ્યક્તિગત ઈવેન્ટમાં ભાગ લીધેલ છે અને તેમાં વિજેતા થયેલ છે કે વિજેતા થયેલ નથી તેની વિગતોની લેખીત બાંહેધરી મેળવી લેવાની રહેશે.
- જે જિલ્લાની ટીમોની સ્પર્ધા રમતી હોય ત્યારે તે જિલ્લાના પંચો/રેફરી સ્પર્ધામાં ફરજ ન બજાવે તેની ખાસ તકેદારી રાખવાની રહેશે.
- એથલેટીકસ અને સ્વીર્મીંગ માટેની રીલે ટીમની પસંદગી.
રાજ્યકક્ષાની જે રીલે ટીમ બનશે તે જિલ્લાકક્ષાની વ્યક્તિગત રમતના આધાર પર બનાવવામાં આવશે. રીલે ટીમ બનાવવા માટે અલગથી પસંદગી ટ્રાયલ આપવામાં આવશે નહીં.
- ખેલ મહાકુંભના ધારાધોરણ મુજબ માનદ વેતન, પ્રવાસ ખર્ચ, નિવાસ, ભોજન, રોકડ પુરસ્કાર, તેમજ આનુષંગિક તમામ ખર્ચ કરવાનો રહેશે.
- સ્પર્ધા સમયે ખેલાડીએ આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, બોનાફાઈડ અને બેંકની પાસબુકની નકલ સાથે લઈને આવવાની રહેશે.

૧. ચેસ

અં-૧૪ અને અં-૧૭ વયજૂથમાં જિલ્લામાંથી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ૫ ખેલાડીઓની ટીમ મોકલવાની રહેશે. (SGFIના નિયમો મુજબ)

૨. યોગાસન

(ક) રાજ્યકક્ષાએ બેસ્ટ ઓફ ધી બેસ્ટ રમાશે.

(ખ) બે ઈવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઈવેન્ટ ફરજિયાત રમવાની રહેશે.

(ગ) અં-૧૪, અં-૧૭ અને ઓપન એજ વયજૂથમાં નીચે મુજબ જિલ્લાકક્ષાએથી રાજ્યકક્ષાએ ખેલાડીઓ ભાગ લેશે.

વ્યક્તિગત યોગ ચેમ્પિયનશીપ	પ્રથમ, દ્વિતીય અને તૃતીય
આર્ટિસ્ટિક (ટ્રેડિશનલ) યોગ ચેમ્પિયનશીપ	પ્રથમ, દ્વિતીય
રીથમિક યોગ ચેમ્પિયનશીપ	પ્રથમ, દ્વિતીય

૩. જીમ્નાસ્ટીક્સ

(ક) ખેલાડી કોઈ પણ બે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.

(ખ) SGFIના નિયમ પ્રમાણે ભાઈઓએ ૬ (છ) પેટા રમત અને બહેનોએ ૪ (ચાર) પેટા રમતમાં ભાગ લેવાનો રહેશે.

૪. રોકેટ રમતની સ્પર્ધાઓ

(ક) “રોકેટ” રમતમાં જિલ્લાકક્ષામાંથી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે કુલ ૫ ખેલાડીઓની ટીમ મોકલવાની રહેશે.

(ખ) કોઈ પણ શાળા કે સંસ્થામાંથી જે તે રમત માટે રજિસ્ટ્રેશન કરાવેલ તમામ ખેલાડીઓ સીધી જિલ્લાકક્ષાએ યોજાતી સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.

પ.આર્ચરી

- (ક) જિલ્લામાંથી ૧ થી ૪ વિજેતા ખેલાડીઓને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મોકલવાના રહેશે.

૬.શુટીંગ

- (ક) રાઈફલ/ટ્રેપ અથવા પીસ્તલ/ટ્રેપમાં ભાગ લઈ શકશે.
(ખ) શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઈફલ/પીસ્તલ લાવવાની રહેશે.
(ગ) બંધી જ સ્પર્ધાઓ ઈન્ટરનેશનલ શુટીંગ સ્પોર્ટ્સ ફેડરેશન/SGFI/ISSFના નિયમો મુજબ યોજાશે.
(ઘ) ઓપન એન્ડ ગ્રૂપમાં ૧૭ વર્ષથી ઉપર કોઈપણ ખેલાડી ભાગ લઈ શકશે.

(૭) કરાટે, આર્ટીસ્ટીક સ્કેટીંગ અને શુટીંગબોલ

- સીધી જિલ્લાકક્ષાએથી શરૂ કરવાની રહેશે.

(૮) રોલબોલ

- સીધી રાજ્યકક્ષાએ સ્પર્ધાઓ યોજવાની રહેશે.
- અં-૧૪ અને અં-૧૭ ની વયજૂથમાં યોજવાની રહેશે.
- આ સ્પર્ધાના આયોજન અંગે સરકારશ્રી માન્ય એસોસીએશન સાથે પરામર્શ કરી વિગતવાર આયોજન કરવાનું રહેશે.

(૯) ઘોડેસવારી (ભાઈઓ) :-

- સીધી રાજ્યકક્ષાએ માત્ર ભાઈઓની સ્પર્ધાઓ યોજવાની રહેશે.
- ઓપન એન્ડ ગ્રૂપવયજૂથમાં યોજવાની રહેશે.
- આ સ્પર્ધાના આયોજન અંગે સરકારશ્રી માન્ય એસોસીએશન સાથે પરામર્શ કરી વિગતવાર આયોજન કરવાનું રહેશે.
- આ સ્પર્ધા માટે ઘોડા પરિવહન, સ્પર્ધાના સ્થળે નિવાસ, નિભાવ વગેરેનો ખર્ચ ઘોડાના માલિક/એસોસીએશને ભોગવવાનો રહેશે.
- સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીએ સ્પર્ધાના સ્થળે પોતાની રીતે આવવાનું રહેશે. નિવાસ, ભોજન અને ઘોડાની સુવિધા સ્વ.ખર્ચ/એસોસીએશનએ કરવાની રહેશે, જ્યારે સ્પર્ધામાં વિજેતાને રોકડ પુરસ્કાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આપવાના રહેશે.
- સ્પર્ધાનું મેદાન અને ટેકનિકલ સ્ટાફ એસોસીએશનએ નિયમ અનુસાર વ્યવસ્થા કરવાની રહેશે.

(૧૨) બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ

- સીધી રાજ્યકક્ષાએથી શરૂ કરવાની રહેશે.
- ઓપન એન્ડ ગ્રૂપ વયજૂથમાં યોજવાની રહેશે.
- સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીએ સ્પર્ધાના સ્થળે પોતાની રીતે આવવાનું રહેશે.
- સ્પર્ધાની સુવિધા માટે અને ટેકનિકલ સ્ટાફ એસોસીએશનએ નિયમ અનુસાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનાં પરામર્શમાં રહીને વ્યવસ્થા કરવાની રહેશે.

(૧૩) સેપક ટકરાવ :

- સીધી રાજ્યકક્ષાએથી શરૂ કરવાની રહેશે.
- અંડર-૧૪ અને અંડર-૧૭ વયજૂથમાં યોજવાની રહેશે.
- સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીએ સ્પર્ધાના સ્થળે પોતાની રીતે આવવાનું રહેશે.
- સ્પર્ધાની સુવિધા માટે અને ટેકનિકલ સ્ટાફ એસોસિએશનએ નિયમ અનુસાર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતનાં પરામર્શમાં રહીને વ્યવસ્થા કરવાની રહેશે.

(૧૪) વડબોલ

- સીધી રાજ્યકક્ષાએથી શરૂ કરવાની રહેશે.
 - અંડર-૧૭ અને ઓપન એજ ગ્રૂપમાં યોજવાની રહેશે.
 - સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીએ સ્પર્ધાના સ્થળે પોતાની રીતે આવવાનું રહેશે.
 - સ્પર્ધાની સુવિધા માટે અને ટેકનિકલ સ્ટાફ એસોસિએશનએ નિયમ અનુસાર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતનાં પરામર્શમાં રહીને વ્યવસ્થા કરવાની રહેશે.
-
- ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ/ નોકરી/વ્યવસાય/ નિવાસ કરતા હોવો જોઈએ. જેના આધાર પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.
 - જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ/વ્યવસાય છેલ્લા ૬ માસથી કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર-પુરાવા કે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.
 - શાળામાં/કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતાં હોય તે તાલુકા/જિલ્લામાંથી ભાગ લઈ શકશે.
 - કર્મચારીના કિસ્સામાં અન્ય રાજ્યમાંથી બદલી/ડિપ્યુટેશનથી આવેલ કર્મચારીએ રજિસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલાં બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલ હોય તો જ ભાગ લઈ શકશે.
 - સ્પર્ધા દરમ્યાન કોઈ પણ પ્રકારનો વિવાદ કે વાંધો હોય તો ખેલાડીએ લેખિતમાં રૂ.૫૦૦/- (અંકે રૂપિયા પાંચસો પુરા) ની પ્રોટેસ્ટ ફી સાથે અડધા કલાકની અંદર જિલ્લા આયોજન કમિટી સમક્ષ પ્રોટેસ્ટ રજૂ કરવાનો રહેશે. જિલ્લા આયોજન કમિટિનો નિર્ણય આખરી અને સર્વેને માન્ય અને બંધન કર્તા રહેશે.
 - ખેલ મહાકુંભની સ્પર્ધા સિવાયના કોઈપણ અકસ્માત કે અન્ય બાબતોથી ખેલાડીને ઈજા કે અન્ય ઘટનાથી ખેલાડીને શારીરિક કે માનસિક નુકસાન થાય તે માટે સરકારશ્રીની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.
 - કોર્પોરેશન તથા જિલ્લાકક્ષાની સ્પર્ધાના ખેલાડીઓની બોનાફાઈડ/એલીજબીલીટીમાં ફોટા ફરજિયાત ચોંટાડેલા હોવા જોઈએ.

પત્રક-બ

ખેલમહાકુલ ર.૦					
તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓને ચૂકવવાપાત્ર રોકડ પુરસ્કાર					
ક્રમ	વિગત	કક્ષા	વિજેતા ક્રમ	વ્યક્તિગત રૂ.	ટીમ રૂ.
અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭, ઓપન એઈજ ગ્રુપ, ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપર					
૧	ખેલાડીઓ	તાલુકાકક્ષા	પ્રથમ	૧૫૦૦	૧૦૦૦
			દ્વિતીય	૧૦૦૦	૭૫૦
			તૃતીય	૭૫૦	૫૦૦
		જિલ્લાકક્ષા	પ્રથમ	૫૦૦૦	૩૦૦૦
			દ્વિતીય	૩૦૦૦	૨૦૦૦
			તૃતીય	૨૦૦૦	૧૦૦૦
		રાજ્યકક્ષા	પ્રથમ	૧૦૦૦૦	૫૦૦૦
			દ્વિતીય	૭૦૦૦	૩૦૦૦
			તૃતીય	૫૦૦૦	૨૦૦૦
શ્રેષ્ઠ શાળા					
૨	શાળા	તાલુકાકક્ષા	પ્રથમ	૨૫૦૦૦	-
			દ્વિતીય	૧૫૦૦૦	-
			તૃતીય	૧૦૦૦૦	-
૩	શાળા	જિલ્લાકક્ષા	પ્રથમ	૧૫૦૦૦૦	-
			દ્વિતીય	૧૦૦૦૦૦	-
			તૃતીય	૭૫૦૦૦	-
૪	શાળા	રાજ્યકક્ષા	પ્રથમ	૫૦૦૦૦૦	-
			દ્વિતીય	૩૦૦૦૦૦	-
			તૃતીય	૨૦૦૦૦૦	-

રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓના કોચને ચૂકવવાપાત્ર રોકડ પુરસ્કાર					
ક્રમ	વિગત	કક્ષા	વિજેતા ક્રમ	વ્યક્તિગત રૂ.	ટીમ રૂ.
અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭, ઓપન એઈજ ગ્રુપ					
૧	કોચ	રાજ્યકક્ષા	પ્રથમ	૧૫૦૦	૧૦૦૦
			દ્વિતીય	૧૨૦૦	૭૫૦
			તૃતીય	૯૦૦	૫૦૦

પત્રક-ક

ખેલમહાકુંભ ૨.૦

કોચના રોકડ પુરસ્કાર ફોર્મ

(ફોર્મ ફરજિયાત અંગેજી કેપીટલ લેટરમાં ભરવાનું રહેશે)

બધી જ વિગતો ભરવી ફરજિયાત છે

ખેલાડીની વિગત									
કોચનું નામ (પુરૂ નામ)									
ઘરનું પુરૂપુરૂ સરનામું									
તાલુકા/જિલ્લો/મહાનગરપાલિકા									
ખેલાડીનું કે.એમ.કે આઈ.ડી									
ખેલાડીનું નામ									
વય જૂથ	<input type="checkbox"/> ભાઈઓ	<input type="checkbox"/> U-9	<input type="checkbox"/> U-11	<input type="checkbox"/> U-14	<input type="checkbox"/> U-17				
	<input type="checkbox"/> બહેનો	<input type="checkbox"/> OPEN AGE							
રમત									
ઇવેન્ટનું નામ									
મોબાઇલ નં-૧									
મોબાઇલ નં-૨									
ઇમેલ આઈડી									
આધાર કાર્ડ નંબર									
બેન્ક ખાતાની વિગત : રોકડ પુરસ્કાર ખાતામાં જમા									
ખાતેદારનું નામ									
એકાઉન્ટ નંબર									
બેન્કનું નામ									
બ્રાંચનું નામ									
આઈ.એફ.એસ.સી. કોડ									
કેન્સલ ચેક આપેલ છે કે નહીં								હા	ના
ચેકની પાછળ વિગત આપવી, નામ, KMK ID મોબાઇલ નંબર								હા	ના

હું ખાતરી આપું છું કે ઉપર જણાવેલ વિગતો સાચી છે. મારા દ્વારા જણાવેલ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા વિનંતી.

(કોચની સહી)

ઓર્ગનાઈઝર/કન્વીનર દ્વારા ભરવાની વિગત

કોર્પોરેશન/જિલ્લાકક્ષા રાજ્યકક્ષા

રમત					
ઇવેન્ટનું નામ					
વિજેતા ક્રમાંક	પ્રથમ <input type="checkbox"/>	દ્વિતીય <input type="checkbox"/>	તૃતીય <input type="checkbox"/>		
ઇનામ મેળવવા પાત્ર રકમ રૂ.					

કન્વીનરનું નામ

હોદ્દો

સહી

ખેલમહાકુંભ ૨.૦

ખેલાડી રોકડ પુરસ્કાર ફોર્મ

(ફોર્મ ફરજિયાત અંગ્રેજી કેપીટલ લેટરમાં ભરવાનું રહેશે)

બધી જ વિગતો ભરવી ફરજિયાત છે

ખેલાડીની વિગત									
ખેલાડીનું કે.એમ.કે. આઇડી									
ખેલાડીનું નામ (અંગ્રેજીમાં)	નામ								
	પિતાનું નામ								
	અટક								
ખેલાડીના ઘરનું પુરેપુરું સરનામું (અંગ્રેજીમાં)									
કોચનું નામ (અંગ્રેજીમાં)									
	<input type="checkbox"/> તાલુકાકક્ષા	<input type="checkbox"/> કોર્પોરેશન/જિલ્લા કક્ષા	<input type="checkbox"/> રાજ્ય કક્ષા						
વય જૂથ	<input type="checkbox"/> ભાઇઓ	<input type="checkbox"/> U-9	<input type="checkbox"/> U-11	<input type="checkbox"/> U-14	<input type="checkbox"/> U-17				
	<input type="checkbox"/> બહેનો	<input type="checkbox"/> OPEN AGE	<input type="checkbox"/> A-40	<input type="checkbox"/> A-60					
રમત									
ઇવેન્ટનું નામ									
મોબાઇલ નં-૧									
મોબાઇલ નં-૨									
ઇમેલ આઇડી									
આધાર કાર્ડ નંબર									
બેન્ક ખાતાની વિગત : રોકડ પુરસ્કાર ખાતામાં જમા									
ખાતેદારનું નામ									
એકાઉન્ટ નંબર									
બેન્કનું નામ									
બ્રાંચનું નામ									
આઈ.એફ.એસ.સી. કોડ									
કેન્સલ ચેક આપેલ છે કે નહીં							હા	ના	
ચેકની પાછળ વિગત આપવી, નામ, KMK ID મોબાઇલ નંબર							હા	ના	

હું ખાતરી આપું છું કે ઉપર જણાવેલ વિગતો સાચી છે. મારા દ્વારા જણાવેલ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા વિનંતી.

(ખેલાડીની સહી)

ઓર્ગેનાઇઝર/કન્વીનર દ્વારા ભરવાની વિગત		
<input type="checkbox"/> તાલુકાકક્ષા	<input type="checkbox"/> કોર્પોરેશન/જિલ્લાકક્ષા	<input type="checkbox"/> રાજ્યકક્ષા
રમત		
ઇવેન્ટનું નામ		
વિજેતા ક્રમાંક	પ્રથમ <input type="checkbox"/>	દ્વિતીય <input type="checkbox"/> તૃતીય <input type="checkbox"/>
ઈનામ મેળવવા પાત્ર રકમ રૂ.		
કન્વીનરનું નામ	હોદ્દો	સહી

પત્રક-5

ખેલ મહાકુંભ વિજેતા ખેલાડીઓનું પરીણામ

તાલુકો :		રમતનું નામ :		વયજૂથ	જાતિ :	અધિકારીશ્રીનું નામ	
					સાઈચો <input type="checkbox"/>		
જિલ્લો :		પેટા રમતનું નામ :	વિજેતા ક્રમ.	બ્રહેમ્નો <input type="checkbox"/>	જિલ્લા રમત ગમત કન્વિનરશ્રીનું નામ		
ક્રમ	કે.એમ.કે.આઈ.ડી. નંબર	ખેલાડીઓનું નામ	મોબાઈલ નંબર	સંસ્થાનું નામ	રીમાર્ક્સ	ધરનું સરનામું પીનકોડ નંબર સાથે	
૧							
૨							
૩							
૪							
૫							
૬							
૭							
૮							
૯							
૧૦							
૧૧							
૧૨							

સહી
જે તે રમતના ચીફ રેકર્ડરી

સહી
જિલ્લા રમત ગમત કન્વિનરશ્રી

સહી
.....

ખેલ મહાકુંભ ૨.૦
રમતવાર ખેલાડીઓની સંખ્યા

Sr.No.	Game	Female	Male	Total
1	Basketball	12	12	24
2	Football	16	16	32
3	Handball	12	12	24
4	Hockey	16	16	32
5	Kabaddi	12	12	24
6	Kho-kho	12	12	24
7	Shooting Ball	10	-	10
8	Tug of War	9	9	18
9	Volleyball	12	12	24
10	Rollball	12	12	24
11	Rugby	12	12	24
12	Beach Vollyball	2	2	4
13	Beach Handball	10	10	20
14	Sepak Takraw	12	12	24
Grand Total		159	149	308



રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત

ખેલ મહાકુંભ ૨૦

(ફોર્મ-અ)



વ્યક્તિગત રમત તથા સાહિક રમત માટેનું પ્રવેશપત્ર (કોઈ પણ બે રમતમાં અને એકજ વયજૂથમાં ભાગ લઈ શકાશે) અં-૯ અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.								(ફોર્મ-અ)									
				KMK ID:													
				આધાર ડાટાસ નંબર													
૧. શાળા/કોલેજ નું નામ*																	
૨. વય જૂથ* (૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ)																	
		અં-૯		અં-૧૧		અં-૧૪		અં-૧૭		ઓપન એજ ગ્રુપ		ભાઈઓ		બહેનો			
૩. રમતનું નામ* (પ્રથમ રમત)										સબ ઈવેન્ટ*							
૪. રમતનું નામ* (બીજી રમત) (બે રમતમાં રજીસ્ટ્રેશન કરવા માટે)										સબ ઈવેન્ટ*							
૧. ખેલાડીનું નામ*										અટક		નામ		પિતાનું નામ			
૨. જન્મ તારીખ*														૩. વજન.....કિગ્રા		૪. ઉંચાઇ.....સેમી	
૫. મોબાઇલ નંબર* :																	
૬. ઇ-મેઇલ આઇ.ડી* :																	
૭. વાલીનું નામ* :										અટક		નામ		પિતાનું નામ			
૮. ઘરનું સરનામું* :																	
૯. જિલ્લો/મહાનગરપાલિકા* :										તાલુકો* :		ગામ* :					
૧૦. બેન્કની વિગત										બેન્કનું નામ:-.....		બ્રાન્ચ:-.....					
૧૧. જાતી										<input type="checkbox"/> જનરલ		<input type="checkbox"/> ઓ.બી.સી		<input type="checkbox"/> એસ.સી		<input type="checkbox"/> એસ.ટી	
૧૨. કોચ/વ્યાયામ શિક્ષકનું નામ																	
૧૩. કોચ/વ્યાયામ શિક્ષકનાં ઘરનું સરનામું:																	
૧૪. કોચ/વ્યાયામ શિક્ષકનો મોબાઇલ નંબર:																	
નોંધ :- *ચિહ્ન કરેલી વિગતો ભરવી ફરજિયાત છે.																	

રજીસ્ટ્રેશન અંગે સુચનાઓ

- અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
- ઓપન એજ ગ્રુપ, તથા અવ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન (૧) શાળા/કોલેજમાં (૨) જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કરેરી (૩) વેબપોર્ટલ <https://khelmahakumbh.gujarat.gov.in> મારફતે કરાવવાનું રહેશે.

બાહેધરી:-

- સ્પર્ધા દરમિયાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહીં.
- હું રજીસ્ટ્રેશન સમગ્ર રાજ્યમાંથી ફક્ત એક જ સ્થળેથી કરીશ અન્યથા માડું રજીસ્ટ્રેશન રદ બાતલ ગણાશે.
- હું _____ આથી બાહેધરી આપું છું કે જો હું ખેલમહાકુંભમાં વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.
- વ્યક્તિગત રમત માટે ફોર્મ-અ અને સાહિક રમત માટે ફોર્મ-અ અને ફોર્મ-બ ભરવું ફરજિયાત છે.
- ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમીન્ટન ડબલ્સ અને મિક્સ ડબલ્સ માટે ફોર્મ-બ ભરવાનું રહેશે.

તા. ___/___/૨૦૨૩

સ્થળ:- _____

ખેલાડીની સહી

વેબસાઇટ: <https://khelmahakumbh.gujarat.gov.in>



રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત

ખેલ મહાકુંભ ૨.૦

(ફોર્મ-બ)



સાંધિક રમત માટે ટીમની યાદીનું પ્રવેશ પત્ર

(કોઈ પણ બે રમતમાં ભાગ લઈ શકાશે)

૧. ટીમનું નામ/શાળાનું નામ / : _____

કોલેજ/સંસ્થાનું નામ/

ડબલ્સ અને મિક્સ ડબલ્સ

માટેના નામ

પ્રથમ પાર્ટનરનું નામ	બીજા પાર્ટનરનું નામ

૨. વયજૂથ : _____

૩. રમતનું નામ : _____

૪. સંપર્ક નંબર : _____

૫. ખેલાડીના નામ : નામ પિતાનું નામ અટક જન્મ તારીખ ઈમેઇલ મોબાઇલ નં જાતી

૧. _____

૨. _____

૩. _____

૪. _____

૫. _____

૬. _____

૭. _____

૮. _____

૯. _____

૧૦. _____

૧૧. _____

૧૨. _____

૧૩. _____

૧૪. _____

૧૫. _____

૧૬. _____

૬. કોચ/વ્યાયામ શિક્ષકનું નામ : _____

૭. કોચ/વ્યાયામ શિક્ષક મોબાઇલ નં : _____

બાહેધરી:-

૧. સ્પર્ધા દરમિયાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહીં.

૨. હું રજિસ્ટ્રેશન સમગ્ર રાજ્યમાંથી ફક્ત એકજ સ્થળેથી કરીશ અન્યથા માત્ર રજિસ્ટ્રેશન રદબાતલ ગણાશે.

૩. હું _____ આથી બાહેધરી આપુ છું કે જો હું ખેલમહાકુંભમાં વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.

૪. દરેક સાંધિક જ રમત માટે ફોર્મ-બ ભરવું ફરજિયાત છે.

તા. ___/___/૨૦૨૩

સ્થળ:- _____

ખેલાડીની સહી

વેબસાઇટ: <https://khelmahakumbh.gujarat.gov.in>



ખેલમહાકુંભ ૨.૦



અંક ૬ (તા.૦૧/૦૧/૨૦૧૫ અને તે પછી જન્મેલા)	
(જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
❖ સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૩૦ મીટર <input type="checkbox"/> સ્ટેન્ડીંગ બોલ જાપ
અંક ૧૧ (તા.૦૧/૦૧/૨૦૧૩ અને તે પછી જન્મેલા)	
(જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
❖ સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૫૦ મીટર <input type="checkbox"/> સ્ટેન્ડીંગ બોલ જાપ
❖ સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
થેસ	<input type="checkbox"/> થેસ
❖ સીધી જિલ્લા/ઝોન/પેરિશનકક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મીટર <input type="checkbox"/> લાબી કુદ
સ્કેટીંગ	ફ્લોડ <input type="checkbox"/> રીક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૨ (૧૦૦૦ મી.)
	ઇનલાઇન <input type="checkbox"/> રીક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪ (૧૦૦૦ મી.)
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
સ્વીમીંગ	વ્યક્તિગત મીડલ (૨૦૦ મીટર)
સ્કેટીંગ	ફ્લોડ <input type="checkbox"/> રોડ ૧ (૧૫૦૦ મી.)
	ઇનલાઇન <input type="checkbox"/> રોડ ૨ (૫૦૦મી) <input type="checkbox"/> રોડ ૨૨૩ ૩ (૧૫૦૦મી)
અંક ૧૪ (તા.૦૧/૦૧/૨૦૧૦ અને તે પછી જન્મેલા)	
❖ સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦મીટર <input type="checkbox"/> લાબીકુદ <input type="checkbox"/> ગોળા ક્રેક
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ
બો-બો	<input type="checkbox"/> બો-બો
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈબો (૫૧ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૪૮ કિગ્રા)
❖ સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦ મીટર <input type="checkbox"/> ૪૦૦ મીટર <input type="checkbox"/> ૬૦૦ મીટર <input type="checkbox"/> ઉચીકુદ <input type="checkbox"/> ચક્રકેડ
થેસ	<input type="checkbox"/> થેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)
❖ સીધી જિલ્લા/ઝોન/પેરિશનકક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
યોગાસન	<input type="checkbox"/> આર્ટિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિથમીક યોગા
આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિવિડ્યુઅલ રાઉન્ડ (વ્યક્તિગત ઓવરબોલ)
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી.
	<input type="checkbox"/> ૪૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલ ૨૦૦ મી.
આર્ટિસ્ટિક સ્કેટીંગ	<input type="checkbox"/> ફ્રી સ્કેટીંગ <input type="checkbox"/> સોલોજાન્સ <input type="checkbox"/> ડ્રીગર <input type="checkbox"/> ક્વોટ્ટ
સ્કેટીંગ	ફ્લોડ <input type="checkbox"/> રીક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૨ (૧૦૦૦ મી.)
	ઇનલાઇન <input type="checkbox"/> રીક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪ (૧૦૦૦ મી.)
જુડો	ભાઈબો <input type="checkbox"/> ૨૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૫-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૨૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૩-૨૭ કિગ્રા <input type="checkbox"/> ૨૭-૩૨ કિગ્રા <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા
કુસ્તી	ભાઈબો <input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા <input type="checkbox"/> ૪૧-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૨૬-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૩ કિગ્રા <input type="checkbox"/> ૩૩-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૩૯ કિગ્રા <input type="checkbox"/> ૩૯-૪૨ કિગ્રા
ટેકવોન્ડો	ભાઈબો <input type="checkbox"/> ૧૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૧ કિગ્રા <input type="checkbox"/> ૨૩-૨૫ કિગ્રા <input type="checkbox"/> ૨૭-૨૮ કિગ્રા <input type="checkbox"/> ૪૧ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૧૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૦ કિગ્રા <input type="checkbox"/> ૨૨-૨૪ કિગ્રા <input type="checkbox"/> ૨૬-૨૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮ કિગ્રાથી ઉપર
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
હૅન્ડબોલ	<input type="checkbox"/> હૅન્ડબોલ
શિક્કી	<input type="checkbox"/> શિક્કી
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ
કરાટે	ભાઈબો <input type="checkbox"/> ૨૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૦-૨૫ કિગ્રા <input type="checkbox"/> ૨૫-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૧૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૨ કિગ્રા <input type="checkbox"/> ૨૨-૨૪ કિગ્રા <input type="checkbox"/> ૨૪-૨૬ કિગ્રા <input type="checkbox"/> ૨૬-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૪ કિગ્રા <input type="checkbox"/> ૩૪-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦ કિગ્રાથી ઉપર

નોંધ- યોગાસન માટે.

- ગ્રુપ A પશ્ચિમીભાગના સર્વોચ્ચતન વસ્તીવાસના અધિકારીઓના નામ પુર્વે ધનુરાસન, ઉત્તાન પાદાસન
- ગ્રુપ B પુર્વે ચક્રાસન, કુટુબાસન, ભુમાસનપુષ્ટી, લલ્લાસન પ્રકાસન, ગિર્ધાસન
- ગ્રુપ C સામાન્યતઃ વ્યાયામસન, ઉચ્ચ કુટુબાસન, ઉત્તરવિશિષ્ટાસન, પદ્મ મયુરાસન, ઉત્તિગ્રાહકાસન
- સાજવણીમાં બેર બોડ ધ બેર રમશે.

નોંધ- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે

- યોગાસનમાં ખેલાડી બાર વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
- એથલેટીક્સ રમતમાં વધુ મા વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
- જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં ફ્લોડ અથવા ઇનલાઇન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- કુસ્તી, ટેકવોન્ડો બોક્સીંગ, કરાટે અને જુડોની રમતમાં કોઇ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.
- કુસ્તી, ટેકવોન્ડો અને જુડોની રમતમાં કોઇ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.

સાંધી સજ્જત કક્ષાથી સરૂ થતી સ્પર્ધા

એકાંતરીકા	<input type="checkbox"/> ૧૮ મી કોર્સ	<input type="checkbox"/> ૪૪ મુખ્ય વી કોર્સ				
સ્પર્ધીક	<input type="checkbox"/> ફી સાર્વજનિક આરબી	<input type="checkbox"/> ફી આરબી-૨/૧૧૫૫	<input type="checkbox"/> ફી આરબી-૨/૧૧૫૫/૧૧૫૫	<input type="checkbox"/> યોગ સ્પોર્ટ્સ ૫૦૦ મી	<input type="checkbox"/> યોગ સ્પોર્ટ્સ ૨૦૦૦ મી	<input type="checkbox"/> મીડલમે ટીમે ૪૩૨૦૨૫૫
	<input type="checkbox"/> યોગ સ્પોર્ટ્સ ૫૦૦ મી	<input type="checkbox"/> યોગ સ્પોર્ટ્સ ૨૦૦૦ મી	<input type="checkbox"/> યોગ સ્પોર્ટ્સ ૫૦૦ મી	<input type="checkbox"/> યોગ સ્પોર્ટ્સ ૨૦૦૦ મી		
	> જીવનકાલીન સાર્વજનિક ખેલતી મોટા પાયા પર ઉત્તરિત્તમ ભાગ લઈ શકશે > જીવનકાલીન સાર્વજનિક જીવન નિયંત્રણ પુસ્તકને કમલેખોથી ૬ (છ) વેલ્ડ થયેલ અને બદલેનોથી ૪ (ચાર) વેલ્ડ થયેલમાં ભાગ લેવાનો રહેશે					
જુડો	આઈએમો	<input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી		
	બદલેનો	<input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી		
કુસ્તી	આઈએમો	<input type="checkbox"/> ૪૮ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૬૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૬૫ કિગ્રા સુધી
	બદલેનો	<input type="checkbox"/> ૪૮ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૬૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૬૫ કિગ્રા સુધી
ટેકવોન્ડો	આઈએમો	<input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૬૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૬૫ કિગ્રા સુધી
	બદલેનો	<input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૬૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૬૫ કિગ્રા સુધી
કુશ્તકાન્ડો	આઈએમો	<input type="checkbox"/> બ્લોક એથલેટિક	<input type="checkbox"/> સોલ્ડીયર ટેકવોન્ડો	<input type="checkbox"/> ટેકવોન્ડો	<input type="checkbox"/> વેલ્ડલેક્સ	<input type="checkbox"/> યોગેલ્ડલેક્સ
	બદલેનો	<input type="checkbox"/> બ્લોક એથલેટિક	<input type="checkbox"/> સોલ્ડીયર ટેકવોન્ડો	<input type="checkbox"/> ટેકવોન્ડો	<input type="checkbox"/> વેલ્ડલેક્સ	<input type="checkbox"/> યોગેલ્ડલેક્સ
જીમ	આઈએમો	<input type="checkbox"/> ડબલ એથલેટિક	<input type="checkbox"/> સોલ્ડીયર ટેકવોન્ડો	<input type="checkbox"/> ટેકવોન્ડો	<input type="checkbox"/> વેલ્ડલેક્સ	<input type="checkbox"/> યોગેલ્ડલેક્સ
	બદલેનો	<input type="checkbox"/> ડબલ એથલેટિક	<input type="checkbox"/> સોલ્ડીયર ટેકવોન્ડો	<input type="checkbox"/> ટેકવોન્ડો	<input type="checkbox"/> વેલ્ડલેક્સ	<input type="checkbox"/> યોગેલ્ડલેક્સ
આરબી	આઈએમો	<input type="checkbox"/> ડબલ એથલેટિક	<input type="checkbox"/> સોલ્ડીયર ટેકવોન્ડો	<input type="checkbox"/> ટેકવોન્ડો	<input type="checkbox"/> વેલ્ડલેક્સ	<input type="checkbox"/> યોગેલ્ડલેક્સ
	બદલેનો	<input type="checkbox"/> ડબલ એથલેટિક	<input type="checkbox"/> સોલ્ડીયર ટેકવોન્ડો	<input type="checkbox"/> ટેકવોન્ડો	<input type="checkbox"/> વેલ્ડલેક્સ	<input type="checkbox"/> યોગેલ્ડલેક્સ
સુવર્ણ	આઈએમો	<input type="checkbox"/> ૫૦ મી.એચ પી.એચ	<input type="checkbox"/> ૫૦ મી.એચ પી.એચ			
	બદલેનો	<input type="checkbox"/> ૫૦ મી.એચ પી.એચ	<input type="checkbox"/> ૫૦ મી.એચ પી.એચ			
કેન્ડીક	આઈએમો	<input type="checkbox"/> ૫૦ મી.એચ પી.એચ	<input type="checkbox"/> ૫૦ મી.એચ પી.એચ			
	બદલેનો	<input type="checkbox"/> ૫૦ મી.એચ પી.એચ	<input type="checkbox"/> ૫૦ મી.એચ પી.એચ			
બોલીંગ	આઈએમો	<input type="checkbox"/> ૫૦ મી.એચ પી.એચ	<input type="checkbox"/> ૫૦ મી.એચ પી.એચ			
	બદલેનો	<input type="checkbox"/> ૫૦ મી.એચ પી.એચ	<input type="checkbox"/> ૫૦ મી.એચ પી.એચ			
ધરણ	<input type="checkbox"/> ડબલ એથલેટિક	<input type="checkbox"/> સોલ્ડીયર ટેકવોન્ડો				
ગેલ્ડલેક્સ	<input type="checkbox"/> ડબલ એથલેટિક	<input type="checkbox"/> સોલ્ડીયર ટેકવોન્ડો				
સેપ્ટા ટેકવોન્ડો	<input type="checkbox"/> ડબલ એથલેટિક	<input type="checkbox"/> સોલ્ડીયર ટેકવોન્ડો				
સ્પોર્ટ્સ ક્લબ	<input type="checkbox"/> ડબલ એથલેટિક	<input type="checkbox"/> સોલ્ડીયર ટેકવોન્ડો				

ખેલમહાકુંભ ૨.૦

પંક્તિ ૧૩ (તા.૦૫/૦૫/૨૦૦૭ અને તે પછી જન્મેલા) જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> ૬૨વી (એક જ રમતમાં ભાગ લઈ શકશે).		
સાંધી થાળા કક્ષાથી સરૂ થતી સ્પર્ધા		
એકાંતરીકા	<input type="checkbox"/> ૧૦૦ મી <input type="checkbox"/> ૨૦૦ મી <input type="checkbox"/> ૪૦૦ મી <input type="checkbox"/> ૬૦૦ મી <input type="checkbox"/> ૮૦૦ મી <input type="checkbox"/> ૧૦૦૦ મી <input type="checkbox"/> ૧૫૦૦ મી <input type="checkbox"/> ૨૦૦૦ મી	
ચક્ષુસ	<input type="checkbox"/> આઈએમો ૨૦૦૦ મી <input type="checkbox"/> બદલેનો ૨૦૦૦ મી (૧૧ મેટર ડિસ્ટન્સે કાલ વાળા)	
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ	
બો બો	<input type="checkbox"/> બો બો	
કમ્બી	<input type="checkbox"/> આઈએમો (૧૫૫ કિગ્રા) <input type="checkbox"/> બદલેનો (૧૫૫ કિગ્રા)	
સાંધી તાલુકા/ઝોનકક્ષાથી સરૂ થતી સ્પર્ધા		
એકાંતરીકા	<input type="checkbox"/> ૧૦૦ મી <input type="checkbox"/> ૨૦૦ મી <input type="checkbox"/> ૪૦૦ મી <input type="checkbox"/> ૬૦૦ મી <input type="checkbox"/> ૮૦૦ મી <input type="checkbox"/> ૧૦૦૦ મી <input type="checkbox"/> ૧૫૦૦ મી <input type="checkbox"/> ૨૦૦૦ મી	
ચક્ષુસ	<input type="checkbox"/> મધ્ય	
વોલીબોલ	<input type="checkbox"/> આઈએમો ૨૦૦૦ મી <input type="checkbox"/> બદલેનો ૨૦૦૦ મી (૧૧ મેટર ડિસ્ટન્સે કાલ વાળા)	
સાંધી જિલ્લા/ઝોનકક્ષાથી સરૂ થતી સ્પર્ધા		
આરબી	<input type="checkbox"/> ડબલ એથલેટિક (આઈએમો બદલેનો)	
ચોરબાગ	<input type="checkbox"/> આઈએમો ૨૦૦૦ મી <input type="checkbox"/> બદલેનો ૨૦૦૦ મી (૧૧ મેટર ડિસ્ટન્સે કાલ વાળા)	
સ્પીનંગ	આઈએમો	<input type="checkbox"/> ૧૦૦ મી.ફી. ક્લાસિક <input type="checkbox"/> ૧૦૦ મી.ફી. ક્લાસિક
	બદલેનો	<input type="checkbox"/> ૧૦૦ મી.ફી. ક્લાસિક <input type="checkbox"/> ૧૦૦ મી.ફી. ક્લાસિક
સ્કેટીંગ	આઈએમો	<input type="checkbox"/> ૧૦૦ મી.ફી. ક્લાસિક <input type="checkbox"/> ૧૦૦ મી.ફી. ક્લાસિક
	બદલેનો	<input type="checkbox"/> ૧૦૦ મી.ફી. ક્લાસિક <input type="checkbox"/> ૧૦૦ મી.ફી. ક્લાસિક
જુડો	આઈએમો	<input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૦ કિગ્રા સુધી
	બદલેનો	<input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૦ કિગ્રા સુધી
કુસ્તી	આઈએમો	<input type="checkbox"/> ૪૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૫ કિગ્રા સુધી
	બદલેનો	<input type="checkbox"/> ૪૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૫ કિગ્રા સુધી
ટેકવોન્ડો	આઈએમો	<input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૫ કિગ્રા સુધી
	બદલેનો	<input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૫ કિગ્રા સુધી
મેડમીડલ	<input type="checkbox"/> સીનગલ	
આરબી/બોલ	<input type="checkbox"/> આરબી/બોલ	
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીનગલ	
વોલ ટેનીસ	<input type="checkbox"/> સીનગલ	
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ	
હોકી	<input type="checkbox"/> હોકી	
ફુટબોલ	<input type="checkbox"/> ફુટબોલ	
કરાટે	આઈએમો	<input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૫ કિગ્રા સુધી
	બદલેનો	<input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૫ કિગ્રા સુધી
રમ્બી	<input type="checkbox"/> રમ્બી	

સાંધી થાળાના આરબી અને બદલેનોના સ્પર્ધીઓએ આરબી અને બદલેનોના સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. આરબી અને બદલેનોના સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. આરબી અને બદલેનોના સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.

નોંધ - સાલકક્ષાથી સજ્જત સુવર્ણી સ્પર્ધા માટે

- યોગ્યતામાં ખેલતી કક્ષા વધુમાં વધુ રહેવામાં ભાગ લઈ શકશે.
- બે ઉત્તરિત્તમ ભાગ લેવા માટે વ્યક્તિગત યોગ્ય યોગ્યતાઓને ઉત્તરિત્તમ પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
- યોગ્યતામાં ખેલતી કક્ષા વધુમાં વધુ રહેવામાં ભાગ લઈ શકશે.
- બે ઉત્તરિત્તમ ભાગ લેવા માટે વ્યક્તિગત યોગ્ય યોગ્યતાઓને ઉત્તરિત્તમ પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
- બે ઉત્તરિત્તમ રમતમાં વધુમાં વધુ રહેવા અને ૧ રીલે ઉત્તરિત્તમ ભાગ લઈ શકશે.
- સાંધી થાળાના આરબી અને બદલેનોના સ્પર્ધીઓએ આરબી અને બદલેનોના સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
- જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં કવોડ બદલેનોના સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
- કુસ્તી ટેકવોન્ડો, બોલીંગ, કસ્ટો અને જુડોની રમતમાં કોઈ પણ એક વચ્ચે વધુમાં ભાગ લઈ શકશે.

❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથેલેટીક્સ	<input type="checkbox"/> ૩૦૦૦ મી <input type="checkbox"/> ૧૦૦ મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ x ૧૦૦ મી રીલે <input type="checkbox"/> વાસ્કુટ <input type="checkbox"/> હથોડા ફેક <input type="checkbox"/> ૫ કી.મી.વોક(ભાઈઓ) <input type="checkbox"/> ૩ કી.મી.વોક(બહેનો) <input type="checkbox"/> ૪૦૦ મી હર્ડલ્સ
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રીસ્ટાઈલ ૫૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બટરફ્લાય સ્ટ્રોક ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૮૦૦મી (ભાઈઓ)
	<input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૪૦૦ મી <input type="checkbox"/> ફ્રીસ્ટાઈલ ૨૦૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦મી <input type="checkbox"/> ફ્રીસ્ટાઈલ રીલે ૪ x ૧૦૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૬૦-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૨ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૧-૯૦ કિગ્રા <input type="checkbox"/> ૯૦ કિગ્રા થી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦ કિગ્રા થી ઉપર
કુસ્તી	ભાઈઓ (ફ્રીસ્ટાઈલ) <input type="checkbox"/> ૬૦-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૨ કિગ્રા <input type="checkbox"/> ૭૨-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૧૧૦ કિગ્રા
	બહેનો (ફ્રીસ્ટાઈલ) <input type="checkbox"/> ૫૩-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૧-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૬૯ કિગ્રા <input type="checkbox"/> ૬૯-૭૩ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૯-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૩ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૭૮ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૩૨-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૯ કિગ્રા <input type="checkbox"/> ૫૯-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા
જીમ્નાસ્ટીક	ભાઈઓ <input type="checkbox"/> ફ્લોર એક્સર્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીજ ટેબલ <input type="checkbox"/> રોપનરીજ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમલોસ <input type="checkbox"/> હોરિજોન્ટલબાર
	બહેનો <input type="checkbox"/> ફ્લોર એક્સર્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીજ ટેબલ <input type="checkbox"/> વેલોસીગ્રામીમ <input type="checkbox"/> અનઈવનબાર <input type="checkbox"/> રૂપ(રિધમીક) <input type="checkbox"/> ક્લબ(રિધમીક) <input type="checkbox"/> બોલ(રિધમીક) <input type="checkbox"/> રોપ(રિધમીક) <input type="checkbox"/> રીબન (રિધમીક)
સ્કેટીંગ	સ્વોડ <input type="checkbox"/> રોડ રેસ ૨ (૩૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રોડ રેસ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ રેસ ૩ (૩૦૦૦ મી.)
સ્પાર્ટ્સ	રીકર્વ સલિડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરઓલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન સલિડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
	કમ્પાઉન્ડ સલિડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરઓલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન સલિડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
શૂટીંગ	<input type="checkbox"/> ૧૦ મી. એર પીસ્તોલ <input type="checkbox"/> ૧૦ મી. પીપ સાઈટ એર સાયફલ <input type="checkbox"/> ૧૦ મી. બોબન સાઈટ એર સાયફલ
વેઈટલીફ્ટીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૪૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૭ કિગ્રા <input type="checkbox"/> ૭૩ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૯૦ કિગ્રા <input type="checkbox"/> ૯૬ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા <input type="checkbox"/> ૧૦૮ કિગ્રા થી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૯ કિગ્રા <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૯ કિગ્રા <input type="checkbox"/> ૬૪ કિગ્રા <input type="checkbox"/> ૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૬ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા થી ઉપર
કેન્સીસ	<input type="checkbox"/> કોર્ટ <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર
બોક્સીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૪૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૪૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા
મલતમલ	ભાઈઓ <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦ થી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા
રોલબોલ	<input type="checkbox"/> રોલબોલ
સેપક ટકગવ	<input type="checkbox"/> ટીમ ઇવેન્ટ
સ્પોર્ટ્સ પ્રતામીંગ	<input type="checkbox"/> લીડ ક્લમીંગ <input type="checkbox"/> સ્પીડ ક્લમીંગ <input type="checkbox"/> બોલરીંગ
સોફ્ટ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ
વુડબોલ	કેરપલે <input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> ટીમ
	સ્કોક <input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> ટીમ

➤ જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

➤ જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ડઝના નિયમ પ્રમાણે ભાઈઓએ ૬ (છ) પેટા રમત અને બહેનોએ ૪ (ચાર) પેટા રમતમાં ભાગ લેવાનો રહેશે.

➤ શૂટીંગ સ્પર્ધામાં શૂટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે. ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

➤ શૂટીંગ સ્પર્ધામાં એર પીસ્તોલની બેક અથવા એર સાયફલ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

ખેલમહાકુંડલ ૨.૦

ઓપન એઈજ ગ્રુપ [તા. ૩૧/૧૨/૨૦૦૬ અને તે પહેલાં જન્મેલા]	
<input checked="" type="checkbox"/> રમતમાં ભાગ લેવાનો હેતુ તેની સાથે <input checked="" type="checkbox"/> કરવી (બેક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
❖ સીધી ગ્રામ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથેલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મી. <input type="checkbox"/> લાબીફ્રે <input type="checkbox"/> લગડીફાઇ ફ્રે <input type="checkbox"/> ગોબાડેક
રસ્સાપ્રેય	<input type="checkbox"/> ભાઈઓ ૫૨૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૪૦ કિગ્રા નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૮૫ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૭૫ કિગ્રા)
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો
❖ સીધી તાલુકા / ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથેલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦મી <input type="checkbox"/> ૪૦૦મી <input type="checkbox"/> ૮૦૦ મી <input type="checkbox"/> ૧૫૦૦ મી. <input type="checkbox"/> ૩૦૦૦ મી <input type="checkbox"/> ઉચીફેક <input type="checkbox"/> બરછીફેક <input type="checkbox"/> ચક્રફેક
ચેસ	<input type="checkbox"/> ચેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)
❖ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
શૂટીંગ બોલ	<input type="checkbox"/> ફક્ત ભાઈઓ માટે
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
યોગાસન	<input type="checkbox"/> આઈસ્ટિક યોગા(ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા (નોંધ- યોગાસનમાં ખેલાડી બાર વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.)
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ
હોકી	<input type="checkbox"/> હોકી
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી. ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી.
	<input type="checkbox"/> ૪૦૦ મી. ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.
ખાટીસ્ટીક સ્કેટીંગ	<input type="checkbox"/> ફ્રી સ્કેટીંગ <input type="checkbox"/> સોલોડાન્સ <input type="checkbox"/> ફીગર
સ્કેટીંગ	સ્વોડ <input type="checkbox"/> રીક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪ (૧૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રીક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪ (૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૩ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૪૪ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૭ કિગ્રા
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૬૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૩ કિગ્રા <input type="checkbox"/> ૫૩-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૭૩ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૩ કિગ્રા <input type="checkbox"/> ૫૩-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૬ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૦-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા
આ ચેરી	<input type="checkbox"/> ઇન્કિયુબે સલિડ (વ્યક્તિગત ઓવરઓલ)
કરાટે	ભાઈઓ <input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૪ કિગ્રા <input type="checkbox"/> ૬૪-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮ થી ઉપર

નોંધ- યોગાસન માટે:

- ગ્રુપ A પદ્મિઓસન, સર્વાસાન, મન્યાસન, બર્ષીમલોચાસન પૂર્વે પશુપાસન, ઉત્તન પહાસન
- ગ્રુપ B પૂર્વે પશુપાસન, કુકુશાસન, જુમાસનપૂર્વે મલોચાસન, બકાસન, ગિર્યાસન
- ગ્રુપ C સામ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુકુશાસન, ઉત્તર કુકુશાસન, ઉત્તરિયાસનિવ્યાસન, પદ્મ મનુષ્ય તન, પ્રિતિજનકરનાસન
- તપાસકાને બેર ઓક ધ બરે સ્વાશે.

નોંધ- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે

- યોગાસનમાં ખેલાડી બાર વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
- એથેલેટીક્સ રમતમાં વધુ મા વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૨ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
- જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં કવોડ અથવા ઇનલાઈન ખેમાંથી બેક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
- કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડો રમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.
- બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઇવેન્ટમાંથી કોઈ પણ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

રજતી	<input type="checkbox"/> રજતી
સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
બેથેલીફ્સ	<input type="checkbox"/> ૫૦૦૦મી <input type="checkbox"/> ૧૧૦ મી હર્ડલ્સ ભાઈઓ <input type="checkbox"/> ૧૦૦ મી. હર્ડલ્સ(બહેનો) <input type="checkbox"/> ૪૦૦મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ X ૧૦૦મી. રીલે <input type="checkbox"/> ૪ X ૪૦૦ મી. રીલે <input type="checkbox"/> વાંસફે <input type="checkbox"/> હથોડા ફેક
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૫૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૮૦૦મી બહેનો <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૧૫૦૦ મી ભાઈઓ <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ રીલે ૪ X ૧૦૦મી.
	<input type="checkbox"/> બેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય ૫૦મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૨૦૦ મી
	<input type="checkbox"/> બેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> મીડલે રીલે ૪ X ૧૦૦મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૪૦૦ મી
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૭૩-૮૧ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૧-૯૦ કિગ્રા <input type="checkbox"/> ૯૦-૧૦૦ કિગ્રા <input type="checkbox"/> ૧૦૦ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૫૭-૬૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૩-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રા થી ઉપર
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૭૪-૭૯ કિગ્રા <input type="checkbox"/> ૭૯-૮૬ કિગ્રા <input type="checkbox"/> ૮૬-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૯૭ કિગ્રા <input type="checkbox"/> ૯૭-૧૨૫ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૫૯-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૨ કિગ્રા <input type="checkbox"/> ૭૨-૭૬ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૪૦-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૨ કિગ્રા
આયેરી	રીફલ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરઓલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્ષ ટીમ
	કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરઓલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્ષ ટીમ
જીમ્નાસ્ટીક	ભાઈઓ <input type="checkbox"/> ફ્લોર એક્સર્સાઈઝ <input type="checkbox"/> વોલીગ ટેબલ <input type="checkbox"/> રોમનરીંગ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમોલોસ્ટ <input type="checkbox"/> હોરિઝોન્ટલબાર
	બહેનો <input type="checkbox"/> ફ્લોર એક્સર્સાઈઝ <input type="checkbox"/> વોલીગ ટેબલ <input type="checkbox"/> બેલેસીંગબીમ <input type="checkbox"/> અન ઈવનબાર
સ્કેટીંગ	સ્કેટ <input type="checkbox"/> રોડ ૧ (૩૦૦૦ મી.)
	ઈન લાઈન <input type="checkbox"/> રોડ ૨ (૫૦૦૦ મી.) <input type="checkbox"/> રોડ ૩ (૩૦૦૦ મી.)
સાઈકલીંગ	<input type="checkbox"/> ૨૦ કી.મી.
શુટીંગ	રાઇફલ ગ્રુપ <input type="checkbox"/> ૧૦ મી. એર રાઇફલ પીપ <input type="checkbox"/> ૫૦ મી. ૦.૨૨ રાઇફલ ૩ પોજીશન
	પિસ્તોલ ગ્રુપ <input type="checkbox"/> ૧૦ મી. એર પિસ્તોલ <input type="checkbox"/> ૦.૨૨ રેઇડ ગ્રાઇવર (ભાઈઓ) <input type="checkbox"/> ૦.૨૨ સ્પોર્ટ્સ પિસ્તોલ (બહેનો)
	ટ્રેપ ગ્રુપ <input type="checkbox"/> શોટગન ટ્રેપ <input type="checkbox"/> શોટગન ડબલ ટ્રેપ
વેઈટલીફ્ટીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૭ કિગ્રા <input type="checkbox"/> ૭૩ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૯ કિગ્રા <input type="checkbox"/> ૯૬ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા <input type="checkbox"/> ૧૦૯ કિગ્રા <input type="checkbox"/> ૧૦૯ કિગ્રા થી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૯ કિગ્રા <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૯ કિગ્રા <input type="checkbox"/> ૬૪ કિગ્રા <input type="checkbox"/> ૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૬ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૭ કિગ્રા <input type="checkbox"/> ૮૭ કિગ્રા થી ઉપર
કેન્સીંગ	<input type="checkbox"/> ફોર્મલ <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર
બોક્સીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩.૫ કિગ્રા <input type="checkbox"/> ૬૩.૫-૬૭ કિગ્રા <input type="checkbox"/> ૬૭-૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૧-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા
બીચ હેન્ડબોલ	<input type="checkbox"/> બીચ હેન્ડબોલ
બીચ વોલીબોલ	<input type="checkbox"/> બીચ વોલીબોલ
ધોડસવારી	<input type="checkbox"/> જમ્પીંગ (ભાઈઓ) <input type="checkbox"/> બેન્ડપુરન્સ (ભાઈઓ)
મલખમ	<input type="checkbox"/> રોપ મલખમ (ફક્ત બહેનો માટે) <input type="checkbox"/> પોલ મલખમ (ફક્ત ભાઈઓ માટે)
સોફ્ટ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ
સ્પોર્ટ્સ ક્રામીંગ	<input type="checkbox"/> લીડ ક્રામીંગ <input type="checkbox"/> સ્પીડ ક્રામીંગ <input type="checkbox"/> બોલરોંગ
વડબોલ	ફેરપ્લે <input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> ટીમ
	સ્ટોક <input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> ટીમ

જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે.

બધી જ સ્પર્ધાઓ ઈન્ટર નેશનલ શુટીંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF)ના નિયમો મુજબ ચોક્કસ

શુટીંગ સ્પર્ધામાં રાઈફલ બચવા પિસ્તોલ અને ટ્રેપ ગ્રુપમાં કોઈપણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

ખેલમહાકુંભ ૨.૦

૪૦ વર્ષથી ઉપર (તા.૦૧/૦૧/૧૯૬૪ થી તા.૩૧/૧૨/૧૯૮૩ દરમિયાન જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા

રસ્સાખેંચ ભાઈઓ ૫૬૦ કિગ્રા બહેનો ૪૮૦ કિગ્રાનોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)

સીધી તાલુકા/ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા

ચેસ ચેસ

નોંધ:- અબોવ-૪૦ અને અબોવ-૬૦ માટે બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઇવેન્ટમાંથી કોઈ પણ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

શુટીંગ બોલ ફક્ત ભાઈઓ માટે

બેડમીન્ટન સીંગલ્સ ડબલ્સ મિક્સ ડબલ્સ

ટેબલ ટેનીસ સીંગલ્સ ડબલ્સ મિક્સ ડબલ્સ

લોન ટેનીસ સીંગલ્સ ડબલ્સ મિક્સ ડબલ્સ

સ્વીમીંગ ૫૦ મી.ફ્રી સ્ટાઈલ ૧૦૦ મી.ફ્રી સ્ટાઈલ ૫૦ મી બેક સ્ટ્રોક ૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦મી.બટર ફ્લાય સ્ટ્રોક

સ્વીમીંગ રમતમાં કોઈપણ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

નોંધ:-યોગાસન માટે (રાજ્યકક્ષા)

અબોવ-૪૦ મા માત્ર એક જ ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે.

આગળ જુકવાનું આસન:- પશ્ચિમોતાસન, ભુમાસન, ઉચ્ચિતપાદઆસન, કુમ્ભાસન, યોગાસન

પાછળ જુકવાનું આસન:- ચક્રાસન, ધનુરાસન, ઉષ્ઠાસન, ભુજાસન, સેતુબંધાસન

કમબાને વળાંક વાપતું આસન-પૂર્ણમાસેન્દ્રઆસન, કમરમરોડાસન, વક્રાસન, જાથનું સમતુલન આસન, પગનું સમતુલન આસન

સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

યોગાસન કોમ્પીનેશન યોગ ચેમ્પીયન શીપ

50 વર્ષથી ઉપર (તા.૩૧/૧૨/૧૯૬૩ અને તે પહેલા જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે ✓ કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

❖ સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖

રસ્સાખેંચ ભાઈઓ ૬૨૦ કિગ્રા બહેનો ૪૮૦ કિગ્રા નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)

❖ સીધી તાલુકા / ઝોન કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖

ચેસ ચેસ

❖ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖

બેડમીન્ટન સીંગલ્સ ડબ્લસ મિક્સ ડબ્લસ

ટેબલ ટેનીસ સીંગલ્સ ડબ્લસ મિક્સ ડબ્લસ

લોન ટેનીસ સીંગલ્સ ડબ્લસ મિક્સ ડબ્લસ

સ્વીમીંગ ૫૦ મી.ફી સ્ટાઈલ ૧૦૦ મી.ફી સ્ટાઈલ ૫૦ મી બેક સ્ટ્રોક

૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી.બટર ફ્લાય સ્ટ્રોક

નોંધ:-યોગાસન માટે (રાજ્યકક્ષા)

અબોવ-૬૦ માં માત્ર એક જ ઈવેન્ટમાં ભાગ લઈ શકાશે. ૫ આસનો કરવાના રહેશે.આગળ જુકવાનું આસન,પાછળ જુકવાનું આસન,કમળને વળાક આપતું આસન, સચનું સમતુલન આસન, પગનું સમતુલન આસન

સ્વીમીંગ રમતમાં કોઇપણ ૩ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.

❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖

યોગાસન કોમ્બીનેશન યોગ ચેમ્પીયન શીપ

ખેલ મહાકુંભ 2.0 સ્પર્ધા માટેનું ઓળખપત્ર

વ્યક્તિગત રમત તથા સાંધિક રમત માટેનું પ્રવેશપત્ર										
	KMK ID:									
	સ્કુલ ડાયસ નંબર									
૧. શાળા/કોલેજ નું નામ*										
૨. વય જુથ* (૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ)	અં-૧૪	અં-૧૭	ઓપન એઈજ ગ્રુપ	અબવ-૪૦	અબવ-૬૦	ભાઈઓ		બહેનો		
૩. રમતનું નામ*	સબ ઈવેન્ટ* <input style="width: 100%;" type="text"/>									
૪. ખેલાડીનું નામ*										
૫. જન્મ તારીખ*										
૬. મોબાઈલ નંબર* :										
૭. ઈ-મેઈલ આઈ.ડી* :										
૮. વાલીનું નામ* :	અટક	નામ				પિતાનું નામ				
૯. વિધાનસભા સીટનું નામ										
૧૦. જિલ્લો/મહાનગરપાલિકા*										
૧૧. વાલીનો મોબાઈલ નંબર*:-										
૧૨. ઘરનું સરનામું*:										
૧૩. જાતી*:	જનરલ	<input type="checkbox"/>	ઓ.બી.સી	<input type="checkbox"/>	એસ.સી	<input type="checkbox"/>	એસ.ટી	<input type="checkbox"/>		
નોંધ :-* ચિન્હ કરેલી વિગતો ભરવી ફરજિયાત છે.										

બાહેંધરી:-

૧. સ્પર્ધા દરમ્યાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહીં.

૨. હું _____ આથી બાહેંધરી આપુ છું કે જો હું વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.

૩. વ્યક્તિગત રમત માટે ફોર્મ-અ અને સાંધિક રમત માટે ફોર્મ-અ અને ફોર્મ-બ ભરવું ફરજિયાત છે.

૪. ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમીન્ટન ડબલ્સ અને મિક્સ ડબલ્સ માટે ફોર્મ-બ ભરવાનું રહેશે.

તા. ___/___/૨૦૨૪

સ્થળ:- _____

ખેલાડીની સહી

ખેલ મહાકુંભ 2.0 સ્પર્ધા માટેનું ઓળખપત્ર

સાંઘિક સ્મત માટે ટીમની યાદીનું પ્રવેશ પત્ર

૧. ટીમનું નામ/શાળાનું નામ /
કોલેજ/સંસ્થાનું નામ/
ડબલ્સ અને મિક્સ ડબલ્સ
માટેના નામ

પ્રથમ પાર્ટનરનું નામ	બીજા પાર્ટનરનું નામ
_____	_____

૨. વિધાનસભા સીટનું નામ

: _____

૩. વયજૂથ

: _____

૪. સ્મતનું નામ

: _____

૫. સંપર્ક નંબર

: _____

૬. ખેલાડીના નામ

: ખેલાડીનું નામ પિતાનું નામ અટક જન્મ તારીખ ઈમેઈલ મોબાઈલ નં
જતી

૧. _____

૨. _____

૩. _____

૪. _____

૫. _____

૬. _____

૭. _____

૮. _____

૯. _____

૧૦. _____

૧૧. _____

૧૨. _____

૧૩. _____

૧૪. _____

૧૫. _____

૧૬. _____

બાહેધરી:-

- સ્પર્ધા દરમિયાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહીં
- હું _____ આથી બાહેધરી આપુ છું કે જો હું વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.

તા. ___/___/૨૦૨૪

સ્થળ:- _____

ખેલાડીની સહી